

સમાનો મન્ત્ર : (૪૫૦વેદ)

સમાની પ્રપા (અથર્વવેદ)

# પરબ

## ઓનલાઈન

સ્થાપના વર્ષ : ૧૯૬૦

વર્ષ : ૮

સપ્ટેમ્બર : ૨૦૧૩

અંક : ૩

પરામર્શનસમિતિ

વર્ષ અડાલજા

રચિલાલ બોરીસાગર

પ્રફુલ્લ રાવલ

પ્રમુખ

મધ્યરથ સમિતિના સભ્ય

પ્રકાશનમંત્રી

તંત્રી  
યોગેશ જોણી.



## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેધાંગી શાનપીઠ .૦૦ ક. લા. સ્વાધ્યાયમંદિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન,  
ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, આશ્રમ માર્ગ, નદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૮  
ફોન અને ફેક્સ : ૨૬૫૮૭૮૪૭

Web-site : [www.gujaratisahityaparishad.org](http://www.gujaratisahityaparishad.org)


[www.gujaratisahityaparishad.com](http://www.gujaratisahityaparishad.com)



ગુજરાતી રચના : ૧ (કંઈદે)  
ગુજરાતી પ્રચાર : (અધ્યક્ષરી)

# પરબ

લખારી : ગોવિશ્વા શોખી



[11]

## આ નું ક મ

પ્રમુખપદેથી : I am going home....., વર્ષી અડાલજા

આ ક્ષણે : અભિવાઈ પ્રત્યે આસિતક સર્જક શ્રી રઘુવીર ચૌધરીને ફેલોશિપ  
ગૌરવનું પ્રદાન, યોગેશ જોખી

કવિતા : ચાર કાવ્યો ૧ ચંદ્રકાન્ત શેઠ, બે કાવ્યો ૧ ધીરુ પરીઅ

સમીક્ષા-ગ્રંથાવલોકન : ગ્રામજગતનું યથાતથ વાર્તિક : ‘નોળવેલ’ ૧ નવનીત જાની, ગાંધીની  
વીરપસલી ૧ દક્ષા વી. પછુણી, ‘જ્યન્ત પાઠકનાં શ્રેષ્ઠ સોનેટો’ :  
‘જ્યન્ત પાઠકનાં શ્રેષ્ઠ સોનેટો’ : વિદ્યાર્થીલક્ષી સંપાદન ૧ દક્ષા. વ્યાસ

પ્રક્રીષ્ટ : ડાયસ્પોરિક ડિલેમા અથવા દરિયા-પારની દ્વિધા ૧ પ્રીતિ સેનગુપ્તા,  
લેખકની ખુમારી ૧ કુલીનચંદ પો. યાલ્લિક

પરિષદ્-પાથેય : સંકલન : રાજેન્દ્ર પટેલ

સાહિત્યવૃત્ત : સંકલન : રાજેન્દ્ર પટેલ

આવરણ : જ્યોતિ ભંડ

## આ નું કંઈ

પ્રમુખપદ્ધથી : I am going home....., વર્ષી અડાલજા 6

આ કષો : અભિલાઈ પ્રત્યે આસ્તિક સર્જક શ્રી રઘુવીર ચૌધરીને ફેલોશિપ ગૌરવનું પ્રદાન, યોગેશ જોધી 10

કવિતા : ચાર કાવ્યો ૧ ચંદ્રકાન્ત શેઠ 18, બે કાવ્યો ૧ ધીરુ પરીખ 20, પાંજરું ૧ રાધિકા પટેલ 21, બે જીત ૧ હરીશ મીનાશ્રુ 22, શું જોઈને.... ૧ ભાવેશ ભહુ 23, ત્રણ ગજલ ૧ ઉર્વીશ વસાવડા 24, પાંચ ગજલ ૧ રાજેશ વ્યાસ 'મિસ્કીન' 25

વર્ત્મા : અદિષ્ટદર્શન ૧ પરંતપ દેસાઈ 28, કોઈક ૧ પ્રકૃત્લલ રાવલ 36

બંગવિનોદ : 'સરવૈયા'ની પાળો, અસુણા જોદેજા 39

ભારતીય સાહિત્ય : ત્રણ કાવ્યો ૧ ત્રણનાથ રથ, અનુ. રેણુકા શ્રીરામ સોની 44

તિદેશી સાહિત્ય : કારણ હું મૂત્ય માટે નહીં રોકાઈ શકી, એમિતી ડિક્રિનસન, અનુવાદ : પ્રદીપ ખાંડવાળા 51

આસ્વાદ : પરંપરાના પારખુ કવિનું આસ્વાદ સોનેટ, ભાનુપ્રસાદ પંડ્યા 53

સમીક્ષા-ગ્રંથાવલોકન : ગ્રામજગતનું યથાતથ વાર્તિક : 'નોળવેલ' ૧ નવનીત જાની 56, ગાંધીની વીરપસલી ૧ દક્ષા વી. પણ્ણી 59, 'જ્યન્ત પાઠકનાં શ્રેષ્ઠ સોનેટો' : 'જ્યન્ત પાઠકનાં શ્રેષ્ઠ સોનેટો' : વિદ્યાર્થીલિકી સંપાદન ૧ દક્ષા વ્યાસ 63

પ્રકીર્ણ : ડાયસ્પોરિક ડિલેમા અથવા દરિયા-પારની દ્વિધા ૧ પ્રીતિ સેનગુપ્તા 66, લેખકની ખુમારી ૧ કુલીનચેંડ પો. યાણીક 70

### આવરણાચિત્ર

આસ્વાદનોંધ : પીયુષ ઠક્કર 73

પરિષદ્-પાથેય : સંકલન : રાજેન્દ્ર પટેલ 76

સાહિત્યવૃત્ત : સંકલન : રાજેન્દ્ર પટેલ 80

પત્રસેતુ : બાબુ સુથાર, હેમન્ત દવે, અસુણા જોદેજા 83

આવરણ : જ્યોતિ ભહુ

આ અંકના લેખકી : 90

ગઈ કાલે જ મહેન્દ્ર મેઘાણીનો અમેરિકાથી ફોન હતો, તમે ચારપાંચ મિનિટ ફાળવી શકશો ને ! હું એક કાવ્ય વાંચ્યું છું, સાંભળજો.

એ કાવ્યનો સારાંશ કંઈ એવો હતો કે કિસમસ નજીક છે અને કવિને એની વ્યસ્તતામાંથી અચાનક જગાડે છે. એને યાદ આવે છે એનાં માતાપિતા, ભાઈભાંડુ સાથે વિતાવેલા પ્રેમના, મસ્તીના દિવસો. હવે બધાં ત્યાંથી ચાલ્યા ગયાં છે, પોતાની દુનિયામાં વ્યસ્ત છે. માનો સ્નેહભર્યો સ્પર્શ ફરકી ઊઠે છે. ઉંબરે ઊભી રહીને પ્રતીક્ષા કરતી માનો ચહેરો મનમાં સાકાર થઈ જાય છે, અને પરિવાર સાથે તહેવાર ઊજવવા એ અધીર બની જાય છે.

આમ તો આવા પ્રકારની ઘણી કવિતાઓ કે લેખો લખાયા હશે. આપણને થાય એવડી તે વળી શી મોટી વાત કવિએ કહી નાંખો !

છેલ્લી પંક્તિઓ મને યાદ રહી ગઈ....

I am going home,

this christmas.

Do you ?

આ ‘હુ યુ’ બે શબ્દો લખીને કવિએ પરિવારથી વિછોડાયાની એમની વાતમાં આપણને સૌને શામિલ કરી દીધા. ફોનમાંથી આવતો એમનો ભાવવાહી સ્વર અને છેલ્લી પંક્તિઓ બોલતાં અમારી બંનેની આંખ ભીની થઈ ગયેલી.

અત્યારે આ નાનોસરખો પ્રસંગ તમારી સાથે શેર કરવાનું એટલે મન થયું કે એક અંગ્રેજી અભિભારમાં બોક્સ કરીને મૂકેલું નાનું લખાણ વાંચ્યું, કંઈક આવા પ્રકારનું, સૌ સાંભળજો હો !

પુસ્તકનો મૃત્યુધંટ વાગી ચૂક્યો છે.

ઘડીભર આઈપોડ, લોપ્ટોપ, સ્માર્ટ ફોન બાજુ પર મૂકી દો.

થોડી વાર શોક મનાવી લો.

કોઈ ટેકનોસાવી પત્રકારે ચબરાકિયા લખાણ તરીકે મૂક્યું હોય કે એટલી જગ્યા ભરવા લખી નાંખ્યું હોય. જે હોય તે પણ ‘પુસ્તકોનો મૃત્યુધંટ’ શબ્દ જ થથરાવી મૂકે તેવો છે.

આપણે જાઇઓ છીએ કે યુગ ટેકનોલોજીનો છે. સમૂહ-માધ્યમોની બોલબાલા છે. શ્રીકૃષ્ણના મુખની જેમ લોપ્ટોપમાં સમગ્ર બ્રહ્માંડ સમયું છે.

કબૂલ કરીએ કે પુસ્તક ખર્ચણ છે, કડાકૂટ છે એમાં. પ્રેસનો ખર્ચ, નિભાવ, કાગળો, દુકાનો અને ગોડાઉનો, કર્મચારીઓના પગાર અને લેખકોની (બિચારી બાપડી) રોંગલ્યી એ બધાનું રૂપાંતર પુસ્તકની છપાયેલી કિંતમાં થાય છે. પાછું પુસ્તકો અમુક જગ્યાએ જ મળે. આજના વસ્ત સમયમાં દૂર દૂર સુધી કોણ પુસ્તક લેવા જશે ? એ ભય સામે પ્રકાશકોએ Dial a Book યોજના અમલમાં મૂકી, ખાસ યોજનામાં સભાસદો બનાવ્યા, અમુક પૈસા ભરનારને વરસે-દિવસે અમુક રકમનાં પુસ્તકો... કાર્યક્રમો....

તો સામે દશ્યશ્વાય માધ્યમોનો જોરદાર હુમલો છે. બરાબરકી ટક્કર. ટી.વી. સ્થિરિયલો અપ્સરા બની વાંચનયક્ષના ઋષિઓનો તપોભંગ કરે છે. એની મનમોહક અદાઓ પર ભલભલા વારી જાય છે. મેટ્રો સ્થિરીઝમાં રોજેરોજ હજારો લોકોને લાંબી મુસાફરી કરવી પડે છે. અત્યાર સુધી લોકલ ટ્રેનમાં ઘણા મુસાફરોના હાથમાં મેળેજીન જોવા મળતાં. હવે કાનમાં ઈયરાલગ બેરવીને, પવનમાં જૂલતી વૃક્ષોની ડાળીઓ જેવા જૂલતા, હાથમાં મોબાઇલ સાથે મુસાફરી કરતા દેખાય છે. (મુંબઈમાં કાનમાં ઈયરાલગ ભરાવી, દુનિયાથી બેખબર લોકલમાં અને પાટા કોસ કરતાં રોજ યુવાનયુવતીઓનો રોજેરોજનો મૃત્યુઆંક ઘણો ઊંચો છે.)

ટી.વી. આવ્યું ત્યારે સાહિત્યકૃતિઓને નજરે નિહાળીશુંનો કેવો ઉમળકો હતો ! શરૂઆતમાં એવું થયું ખરું. ‘તમસ’, ‘શ્રીકંત’, ‘મિરજા ગાલિબ’, ‘કર્ચી ધૂપ’, ‘ભારત એક ખોજ’ લાંબી યાદી થઈ શકે. મુંબઈ-ગુજરાતી ચેનલ પરથી ‘તુલસીક્યારો’, ‘વેવિશાળ’, ‘દરિદ્રનારાયણ’, ‘વળમણણ’ ગુ.સા.ની ઉત્તમ ટૂંકી વાર્તાઓ.... કેવી સરસ કૃતિઓ કર્યાનું યાદ છે. તો અમદાવાદ ચેનલ પરથી પણ સરસ કામ થતું હતું.

પણ હવે તો બાટીમાંથી જીન નીકળી ગયો છે અને હુકમ મેરે આકા કહેતાં કુરિનિશ બાળી કેવી કેવી માંગ પૂરી કરી રહ્યો છે એ કહેવાની શી જરૂર ?

એક સમયે ‘આકાશવાણી’ પણ તાજીગીસભર કાર્યક્રમો કરતું.

વસુબહેન તેમના અનુભવની એક સરસ વાત કરી હતી.

ત્યારે વસુબહેન મુંબઈ કેન્દ્રનાં નિયામક હતાં. મારા ઘરની જ બાજુમાં રેડિયોસ્ટેશન. પણ્યા પાસે લેખ – નાટક માટે ઘરે આવે. અમે બાજુના રૂમમાં બેસી ગણ્યાં મારીએ, ચા-નાસ્તો કરીએ. પણ્યા લખતા હોય. પણ્યા તે જ વખતે લખી આપે ને વસુબહેન સ્કિપ લઈને જાય.

રાજકોટ કેન્દ્રમાં હતા ત્યારે એમણે પ્રયોગ કર્યો હતો. કવિ દુલા કાગનું મજાદર ગામે અવસાન થયું. આકાશવાણીએ અંજલિ. તો આપી, પણ વસુબહેનને થયું દુલા કાગ. તો આપણું ભૂષણ. એમને વિશેષ અંજલિ આપવી જોઈએ. તેમના મૃત્યુના માસીસાને દિવસે ગામમાં જે તેલી પર બેસતા ત્યાં કલાકારો એન્જિનિરસને લઈને એ ગયા. આમ તો હેઠેલી જેવું ગામ. પણ ગામેગામથી પગે ચાલીને ગાડાં, ટ્રેક્ટર, બસમાં લોક દલવાવા માંડયું. લોકો પોતાના કવિને અંજલિ આપવા આવી પૂર્યા.

કાર્યક્રમ જમાવટ કરી. લોકસાહિત્યના અમર કવિને અસંખ્ય લોકોએ અંજલિ આપી. તેમનાં પત્નીએ કહ્યું, ‘બેટા ! તારા બાપુ વડલાની વાત કરતા. એમાં અસંખ્ય પંખીઓ આશ્રય પામ્યા. એક દી વડલામાં આગ લાગી. વડલાએ કહ્યું, તમારે પાંખો છે. ઉડી જાઓ. મારી કાચા બળીને ભસ્મ થશે ત્યારે તમે એ પર આવીને કિલ્લોલ કરશો તો મારા જીવને શાતા વળશે. બેટા, તુંય તારા બાપુની ભસ્મ પર ટહુકો કરી શાતા આપવા આવી.’

માધ્યમોની આ શક્તિ, એની આ પહોંચ સાથે શું શું ન થઈ શકે ? પણ શું થાય છે તે તો આપણી નજર સામે છે. આપણો તો લોકશાહી દેશ. જેને જેમ ઉચ્ચાર કરવા હોય, રેઢિયાળ રજૂઆત કરવી હોય તેને સ્વતંત્રતા. ગણ્યાગાંધા નિષ્ઠાવાન મૌલિક વિચારવાળા આયોજકો-અફસરોની સામે કહેવાતા પ્રોફેશનલ્સની મોટી ઝોજ.

કુછ ભી હો સકતા હૈ.

વસુબહેન એક રમૂજ વાત નોંધી છે.

અભી જાન્યુ. સવારે ૧૧ વાગ્યે શહીદોની સ્મૃતિમાં. ૧૧થી ૧૧ અને બે મિનિટ મૌન પાળવામાં આવે છે. મૌનનો સમય પૂરો થતાં યંત્રવત્ ઉદ્ઘોષકે જાહેર કર્યું કે આપ ૧૧થી ૧૧ અને ૨ મિનિટ સુધી મૌનનો કાર્યક્રમ સાંભળી રહ્યા હતા.

દી બુક્સ, ઇન્ટરનેટ વગેરે વીજાણુ માધ્યમો આવકાર્ય તો છે જ. હોય જ. બદલાતા સમય સાથે તાલ મેળવ્યા વિના તો શી રીતે ચાલે !

એક તો પુસ્તકપ્રકાશન ખર્ચણ. જુદા જુદા વિષયો, રુચિનાં પુસ્તકો તો અધધધ થાય. બધાંને સમાવવાં ટ્રકો જોઈએ. દૂર દૂર પહોંચાડવાનું અઘરું અને મોંઘું. પુસ્તકો પોતે પણ મોંઘાં, તેથી નાનાં નાનાં સ્થળોએ ગ્રંથાલયો ઊભાં કરવાં પરવડે નહીં. એક કમ્પ્યુટર અને ટેલિવિઝનની લાઈન લેવી સસ્તી પડે. એકમાં જ અસંખ્ય પુસ્તકો અને બીજું બહુયે, પણ એક સમયે એક જ વાંચી શકે. કમ્પ્યુટર રિસાય, નેટવર્કના પ્રોબ્લેમ... તો કોણ મનાવે – રીપેર કરે, રોજેરોજ બદલાતી ટેકનોલોજીને લીધે આજે મોંઘું કમ્પ્યુટર ખરીદો એ જૂનું પણ થાય અને બંગારનીય સમસ્યા.

જેમને પરવડી શકે, જે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તેમને માટે ઇલેક્ટ્રોનિક્સનો જ્ય હો ! દુનિયાને કોઈ પણ છેડે, કોઈ પણ સમયે એક કિલ્ક અને પુસ્તકભંડારનાં દ્વાર ખૂલ જા સિમસિમની જેમ ખૂલી જાય.

પણ પુસ્તકપ્રેમીઓનીયે સંખ્યા કમ. નથી. પુસ્તકોના વેચાણમાં તેજ આવતી જ રહે છે. ચોક્કસ. માહિતી. માટે ઇન્ટરનેટ રીતસર કામધેનું છે. પણ લાંબો સમય, સતત. સ્કીન સામે બેસી રહેનાર થાકી જાય છે, આંખો દુખે છે, ઝગમગતો પડદો નુકસાન પણ કરે છે.

પુસ્તકપ્રેમીઓ પોતાનો મોરચો સંભાળતાં કઢે છે કે પુસ્તક ધાપવા એક જ વાર વીજળીની જરૂર પડે. બસ પછી નેટવર્ક, બેટરી કે પ્લાગની જરૂર નથી પડતી. નાનું,

રૂપાળું ગમે ત્યાં લઈ જાઓ. જરૂર છે તો સાચ, બધા જ પ્રકાશકોનાં પુસ્તકોના એક બુકસ્ટોરની. જુદા જુદા પ્રકાશકોનાં પુસ્તકો એક મોટા સ્ટોરમાં સાથે મળે તો એ નવું મહાતીર્થ થશે. અંદર નાનું કાઢે હોય, આરામદાયક બેઠક હોય, તો ચોક્કસ પુસ્તકપ્રેમીઓ આવશે.

આવો એક સહિયારો પ્રયાસ થાય એવું સ્વભન સેવવામાં કશું નુકસાન નથી. એવી જગ્યાએ બ્રાઉઝર્સ અને ખરીદનાર બંને આવશે.

મારા ઈમેઇલ પર મહેન્દ્ર મેઘાણીએ મોકલી હોત તો હું વાંચી લેત પણ કોઈ પુસ્તકનાં પાનાં ફેરવતાં, અજાણ્યા કવિતા જોઈ એમને રૂપર્ણ ગઈ અને ભાવભરી રીતે વાંચી કે અમારાં વચ્ચે સંવેદનાનો સેતુ બંધાયો.

કમ્પ્યુટર ભાવનિભોર થઈ કવિતા વાંચી સંભળાવી શકશે ! મને કહી શકશે....

I am going home


this christmas,

Do you ?

આ કાણો

અભિવાઈ પ્રત્યે આસ્ટ્રિક સર્જક

શ્રી રઘુવીર ચૌધરીને ફેલોશિપ ગૌરવનું પ્રદાન



સાહિત્ય અકાડેમી, દિલ્હી દ્વારા તા. ૨૦ જુલાઈ ૨૦૧૭ના રોજ પ્રતિષ્ઠિત ભારતીય સર્જક શ્રી રઘુવીર ચૌધરીને અકાડેમીના અધ્યક્ષશ્રી વિશ્વનાથપ્રસાદ તિવારીના હસ્તે ફેલોશિપ ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું. આ બાબતે આપણને આનંદ અને ગૌરવની લાગણી થાય. પણ એ સાથે જ સવાલ જાણે – ‘ઉપરવાસ’ની માટે કે સમગ્ર સર્જન માટે જ્ઞાનપીઠ કેમ નહિ ?! અન્ય ભારતીય ભાષાઓના જ્ઞાનપીઠવિજેતા સર્જકોની કૃતિઓના અનુવાદોમાંથી પસાર થતાં થાય, – આવું કામ, બલકે આથીય સારું કામ આપણી ગુજરાતી ભાષામાં થયું છે તો એ કામને, એના સર્જકને જ્ઞાનપીઠ સન્માન કેમ નહિ ? કેન્દ્રમાં રજૂઆત બાબતે આપણે ઊંઝા ઉત્તરીએ છીએ ? હિંદી તથા અંગ્રેજમાં આપણી ભાષાની ઉત્તમ કૃતિઓના સારા અનુવાદો થતા નથી ?

કોવેજમાં ભણતો ત્યારે ‘અમૃતા’ થકી રઘુવીર ચૌધરી મારી ભાવકચેતનામાં વસી ગયેલા. ૧૯૭૪પ્રમાં M.Sc. માટે અમદાવાદ આવવાનું થયું ત્યારે ભાષાભવનમાં એમને મળવાનું થયું. વાંસ જેવો લાંબો, પાતળો, મજબૂત દેહ. રૂપાળા ચહેરા પર પ્રતિબાનું તેજ. ગૌર વર્ણ. અણીદાર નાક. વિશાળ કપાળ. પ્રમાણમાં લાંબા વ્યવસ્થિત ઓળેલા વાળ. પાતળા હોઠ પર ફરફરતું સેહલ્યર્દું મધુર સ્થિત. વાતવાતમાં હળવા કટકખર્યો સૂક્ષ્મ – બૌદ્ધિક વિનોદ. પછી હોઠના બેય ખૂણોથી રેલાતું સ્થિત અને મુખ પર મીઠડો મલકાટ. પાણીમાં સાગરની વાણી તથા મનુષ્યનો અને ધરાનો શોક સાંભળી શકતા કવિ-કાન, ખેડાયેલા ખેતર સમું હૈયું – જેની ચયકતી ભીનાશ નજરમાંથી નીતરે. જરી ઊંડા, ઝીણી-ચમકતી આંખો – ઝીણું જોનારી-પરખનારી, આકાશમાં કેડી પાડનારી, નીરવતાને સઢ્હી ફરકાવનારી, પેલે પાર તાગનારી ને સાથે સાથે કોક છીપમાં બેઠી બેઠી ઝૂરતી સુંદરતાને નીરખનારી-માણનારી....

અભિવાઈ પ્રત્યેની એમની પરમ શ્રદ્ધા આ ઝીણી આંખોમાં ઠરેલી જણાય. આ ઝીણી આંખો સમયને કઈ રીતે નિરખે છે ?! –

‘આ સમય સૂર્યનો પદ્ધાયો  
ને સૂર્ય સમયનો ચહેરો !’

એમનો જીવ સદાય ધરામાં – ખેતરની માટીમાં રોપાતો, પોષણ પામતો વિસ્તરતો રહ્યો છે. ખેતરમાં તેઓ શ્રમ કરતા રહ્યા છે. આ ઉંમરેય, ખેતરમાં શ્રમ વગર એમને

જાણે પ્રાણવાયુ મળતો નથી. શ્રમના કારણે એમના દેહમાં ચરબી ક્યારેય જમા નથી થઈ. દીર્ઘકલ્પિતા હોય કે દીર્ઘનવલકથા કે નવલત્રધી – એમના શબ્દમાંથી નિરર્થકતાનો મેદ જમા નથી થયો. આ ઉમરેય તેઓ થાકતા-કંઠાળતા નથી. નગરનો થાક તેઓ બાપુપુરા જઈ ખેતરમાં શ્રમ કરીને ઉતારે છે ('કૂટપાથ પર ઊભા રહેવાનો થાક / ખેતરમાં કામ કરીને ઉતારું છું.')ને ખેતરના શ્રમનો થાક તેઓ શબ્દમાં વિહરીને કે નવોહિતોની કવિતા-વાર્તા સાંભળીને કે કોઈ કલાકારોના કંઠે કાવ્ય-ગાન કે સંગીત સાંભળીને કે નવું નાટક નિહાળીને ઉતારે છે.

આધુનિકતાનું પૂર ઊમટેલું એ દ્વારકાઓમાં હતાશા-નિરાશા-શુન્યતાની વાતો થતી, ઈશ્વરનો છેદ ઊડાડાતો, સહુ આધુનિકતાનાં ચશમાંમાંથી બધું જોતા; પણ આ સર્જક હુંમેશાં નકાર સામે શ્રદ્ધાપૂર્વક વિદ્રોહ કરતા રહ્યા છે. 'સર્જકની આંતરકથા'માંના લેખમાં 'અભિલાષ પ્રત્યે આસ્ટિક' એવા આ સર્જકે નોંધ્યું છે –

'લેખકે જગતનાં વીકિક, વૈચારિક – તમામ રૂપો સમક્ષ ખુલ્લા રહેવું જોઈએ,  
બંધાઈ ન જતાં અભિલાષ પ્રત્યે આસ્ટિક રહેવું જોઈએ.'

('સર્જકની આંતરકથા', ૧૯૮૪, પૃ. ૭૫)

ખેતરમાં કામ કરનારમાં, બીજ રોપાયા પછી – વરસાદ આવે – કુપળ કૂટે, છોડ મોટો થતો જાય, ઘટાદાર વૃક્ષ બને, ફૂલ બેસે, ફળ આવે તાં સુધીની ધીરજ હોય. રધુવીરભાઈમાંથી આવી ધીરજ છે. એમનું દીર્ઘકાવ્ય 'બચાવનામું' પ્રગટ થયું ઈ. સ. ૨૦૧૧માં. લગભગ ૧૯૮૦થી તેઓ આ કાવ્ય માંનીને બેઠેલા ! ૧૯૮૪માં પ્રગટ થયેલ ઉમાશંકરસંપાદિત 'સર્જકની આંતરકથા'માંના એમના લેખમાં નોંધ્યું છે –

'ચાર-પાંચ વર્ષથી એક દીર્ઘકાવ્ય લઈ બેઠો છું. પૂરું થતું નથી. વચ્ચે મોટા મોટા વિરામ પડે છે. જીવનના નકારાત્મક અંશને – ઉધાર પાસાને વ્યક્ત કરતી 'આધુનિકતા'નો મહિમા હોય ત્યારે ખાલીપો ખાળતી સુંદરતાની વાતો કરવી એ ધૂષ્ટતા જ કહેવાય ને ! તેથી કાવ્યનું નામ રાખ્યું છે : 'બચાવનામું.' આજે મૂલ્યોની વાત કરનાર આરોપીના પીજારામાં મુકાયો છે. આ કાવ્યમાં પરમતત્ત્વ અને સંતુલનનો સંબંધ પણ સમજવો છે.'

('સર્જકની આંતરકથા', પૃ. ૭૫)

દીર્ઘકાવ્ય 'બચાવનામું'ની શરૂઆત – ઉધાર આમ થાય છે –

'સત્ય રામનું, પ્રેમ કૃષ્ણનો, વિરાગ શિવનો,  
બાસે કર્યો સમાસ સકલ સંસારી જીવનો.'

રધુવીર ચૌધરી પણ સકલનો સમાસ કરનારા સર્જક છે. આ સર્જકના શબ્દનું, શબ્દનું પ્રયોજન શું છે ? એના ઉત્તરમાં 'બચાવનામું'માંથી જ પંક્તિ યાંકું –

'વિતથભર્યો વંટોળ તિશમાં ઝર્ણબવાનો,  
દીવો થાય ના રાણો, શબદ ધર્ઢું હું આડો.'

આ સર્જિકે ‘સદ્ગ’નો તથા મૂલ્યોનો સતત મહિમા કર્યો છે. ને ‘અસદ્ગ’ને ય તેઓ વિકારતા નથી છે. એમનામાં મનુષ્યનો અને સમાજનો અત્યંત ઉદારતાપૂર્વકનો સ્વીકાર જોવા મળે છે. એના મૂળમાં એમની અધ્યાત્મની ઊંડી સમજ રહેલી છે. મનુષ્ય અને સમાજ ઉર્ધ્વતર થતો જાય એવી એમની ઝંખના રહી છે. મનુષ્ય અને સમાજ માટેનું એમનું આસ્થાભર્યું દર્શાઈ-Vision એમના શબ્દમાંથી પ્રગટનું-વિકસનું રહ્યું છે. શુભ-અશુભમાં વહેંચાયેલા આ જગતમાં ઈષ્ટ-અનિષ્ટના ભાગલા નાબૂદ થાય અને સાર્વત્રિક એકતાની અનુભૂતિ થઈ શકે એ દિશામાં એમના શબ્દની મથ્થામણ રહી છે. એમનો શબ્દ ધરામાં વવાતા બીજ સમે રહ્યો છે. ગોકુળ-વૃદ્ધાવન સમું જ ‘ધરાધામ’ તેઓ ઝંખે છે. ‘નવનીતસમર્પણ’ દીપો. ૨૦૧૨માં એમનું વિલક્ષણ કાવ્ય ‘ધરાધામ’ પ્રગટ થયું છે – એમાં ‘મૂળ’ અને ‘મારી’નો મહિમા કર્યો છે.

રધુવીર ચૌધરીનો જન્મ તા. ૫-૧૨-૧૯૮૮ના રોજ મહેસાણા જિલ્લાના બાપુપુરા ગામે જેડૂત પરિવારમાં. એમના વડવા વિશે વાત કહેવા ‘બચાવનામું’માંની ‘વડવા’ની પંક્તિઓ ઉતારું –

‘વડવા મારા ખેતર થઈને જીવતા  
છોડ નીંઘલે  
અને કણસલે દાણેદાણા દૂધ ભરાતાં  
– છોડ નર્યો રોમાંચ –  
પવન ત્યાં ચણવા આવે,  
પોરો ખાતો ધજા ધર્મની ફરકાવીને  
જતો ગામ પરગામ...  
... ...  
... ...  
એ વડવા મારા  
ગામ, સીમ, વન ગાઢ, સરોવર સાચવતા.  
સહુની સંગાથે  
સમરસ ભાવે જીવતા.’

વડવાઓનો આ વારસો રધુવીરભાઈએ જાળવ્યો છે, વિસ્તાર્યો છે. એમના પિતા દલસિંહ ‘ભગત’ ગામની ભજન-મંડળીના પ્રમુખ. તેઓ નરથાં વગાડતા ને ભજન ગાતા. પિતા ખાસ ભાડોલા નહિ, પણ મનમાં ગરબી રચતા, ગાતા અને ગવડાવતા. ગરબી જામી હોય ત્યારે નાનકડા રધુવીર ઉઠીને વચ્ચે નાચતા. થાકતા નહિ. થાક એમના સ્વભાવમાં જ નથી. પરિશ્રમી, માયાળું માતા. એમને મન ‘માયા એ જ મોક્ષ.’ પિતાજી મંદિર ગયા હોય ત્યારે મા ઘરને ઓટલે બેસતાં ને એકેએક વટેમારગુની ભાળ લેતાં. ને નાતની આખી ‘સત્યાવી’ને ઓળખતાં. રધુવીર પણ જાણે સમાજને ઓટલે બેસીને

શબ્દની, સાહિત્યની અને સમાજની ભાળ વેતા રહે છે. ગ્રામની ભજન-મંડળી થકી ગળથુથીમાંથી જ એમના શિશુ-કાનમાં લય અને તાલનું મધ્ય રેડાપું. આ ભજન-મંડળીના કારણે નરસિંહ-મીરાં-દ્વારામ એમના ચિત્તમાં રોપાત્માં ગયાં. માણસાની શાળામાં એમને ભોગાભાઈ પટેલ જેવા શિક્ષક મળ્યા ને ઉમાશંકર-સુન્દરમ્રૂ-રાજેન્દ્ર-નિર્જન-પ્રધલાંદ-શ્રીધરાણી-પ્રિયકાન્ત આદિના કાચ્ચવિશ્વમાં પ્રવેશવાની એક બારી ખૂલી ગઈ. સ્મરણશક્તિય એમને વારસામાં મળેલી. વિસનગર કોલેજમાં જી. એન. ડિકેએ સંસ્કૃતનો સ્વાદ ચ્યાલ્ક્યો. અનેક શ્લોકો એમને યાદ ને છંદ્યો જાણે જલ્બને ટેરવે રહે. અમદાવાદમાં ડૉ. રામદરશ મિશ્ર મળ્યા ને હિંદી સાહિત્યનો આસ્વાદ શરૂ થયો. કોલેજકાળમાં તેઓ ખૂબ સુંદર વસ્ત્રોમાં સજજ થતા ને રૂડા-રૂપાળા લાગતા એવું ચંદ્રકાન્ત શોઠ પાસેથી સાંભળેલું. કોટ, પેન્ટ, ગાઈ... છેલ્લાં થોડાં વરસોથી ખાદી સિલ્કનો બદામી જલ્બો ને શિયાળો હોય તો ઉપર સુંદર બંડી, ઉનાળામાં સરસ ગોગલ્સ.

દસેકની વયે લેખનનો પ્રારંભ થયેલો. અનુકૂળ વાતાવરણ મળતાં એમની સર્જકભૌયમાં રોપાયેલાં બીજ વિકસતાં રહ્યાં. અમદાવાદ આવ્યા બાદ એમને ‘બુધસભા’ મળી. મધ્યમાખીને જાણે પુષ્પોસભર બગીચો મળ્યો. અમદાવાદમાં એમને ઉમાશંકર, રસિકલાલ પરીખ, નગીનપુરાસ પારેખ, ભગતસાહેબ, ભાયાણીસાહેબ જેવા સારસ્વતોનો સત્સંગ સાંપડ્યો. ચંદ્રકાન્ત શોઠ, લાભશંકર ઠાકર તથા અન્ય કવિમિત્રો મળ્યા. શબ્દસાધના સમજ્ઞપૂર્વક વિકસતી રહી. શબ્દનો સાક્ષાત્કાર થતો રહ્યો. એમણે નોંધ્યું છે –

‘એ ખરું કે કોઈ શબ્દમાં કોઈ અર્થ શાચ્છત હોતો નથી. પણ શબ્દ અને અર્થનો કલાત્મક સંયોગ થાય તો શાચ્છત સૌંદર્ય સંભવે. શબ્દ એ પર્ણપુષ્પ છે તો અર્થ છે મૂળિયાં. વંજનાનું મહત્ત્વ સુંગધથી સહેજ પણ ઓછું નહીં.’

(‘સર્જકની આંતરકથા’, પૃ. ૭૫)

‘અનુભવથી અવાજ સુધી’ લેખમાં એમણે લખવા વિશે આમ નોંધ્યું છે –

‘લખવું એટલે સંડોવાવું – involve થવું. સમયમાં અને સમય દ્વારા સમગ્રમાં. ‘મારે અભિપ્રાય કે અભિગ્રહ નથી’ એમ કહીને છટકી ન શકાય. માત્ર સંવેદન નહિ, દસ્તિકોણ પણ ખરો. એટલું જળવાય કે દસ્તિકોણ મમત્વનો વિષય ન બને. બાકી, માત્ર શબ્દની શોધ ન ચાલે, સ્વની સંવિત્ત પણ ખરો. એ પલ્લું વજનદાર હોવું જોઈએ, સમતુલા જળવાય એટલું.

એક બાજુ ‘હું’ અને બીજુ બાજુ આખું વિશ્વ. વિશ્વમાં ‘હું’ વિસ્તરે અને વિશ્વ ‘હું’માં જિલાય; સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનો ભેદ અભેદમાં પરિણમે – અનુભવ અવાજમાં પરિણમે.’

શબ્દ અને શબ્દની ઓળખ-પરખ, અભિલાઘીની જાગરૂકતા, અંદર-બહારનું દર્શન, સાંસ્કૃતિક ઈતિહાસનો અભ્યાસ તથા પુનર્લોખન માટેની કટિબદ્ધતા એમના શબ્દને

ઓજસ તથા સૌંદર્ય આપે છે. તેઓ સંવેદન પર હમેશાં ભાર મૂકે છે. પણ વિચાર તથા દર્શનને અવગણતા નથી, એના સંતુલન બાબતે તેઓ સ-જાગ – સ-ભાન છે.

ભાગાતા ત્યારે વેકેશન દરમિયાન તેઓ વિનોબાના ‘ભૂદાન આંદોલન’માં જોડાયેલા. ‘નવનિર્માણ આંદોલન’માં પણ સક્રિય રહેલા. ૧૯૭૫માં કટોકટીના વિરોધમાં તેમણે અવાજ ઉઠાવેલો. કચ્છના ભૂકુંપ પછી તેઓ નિઃસહાયની વહારે આવેલા. ગોધરાકંડ પછી, ઘા રૂઝાય એ માટે પણ તેમણે ચૂપચાપ કામ કરેલું. ૧૯૮૫માં તેઓ શિક્ષક ભોળાભાઈ સાથે ગુજરાતી સાહિત્ય પરિષદના નિર્યાદ ખાતેના અધિવેશનમાં ગયેલા. ત્યારથી પરિષદ સાથે જોડાયેલા. તંતુ દઢ થતો ગયો. પરિષદ માટે એમણે ખૂબ સમય-શક્તિ આપ્યાં છે. પરિષદનું ભવન પણ એમને આભારી છે. જીવ રેડીને પરિષદ માટે તેઓ સતત કામ કરતા રહ્યા છે. નવોદિત લેખકો માટે પણ તેઓ સમય-શક્તિ આપતા રહ્યા છે. નવોદિત-સર્જક શિબિરોમાં સતત રોકાઈને તેમણે બીજ સિંચવાનું કામ કર્યું છે. પોતે નવોદિત હતા ત્યારે મુરબ્બીઓનું સ્નેહભર્યું માર્ગદર્શન મળ્યું એને તેઓ ભૂલ્યા નથી. એમને પ્રશ્ન થતો રહે છે : ‘પુરોગામી પેઢી પાસેથી અમને જે મળ્યું એના પ્રમાણમાં અમે સર્જનાત્મક વાતાવરણને પોષવા શું કર્યું ?’ – વિદ્યાર્થી શિબિરમાંથી વાચનના સમયે નાસી જતા હર્ષદ ત્રિવેદી ને જગાદીશ વ્યાસને તેઓ શોધીને પકડી લાવતા.

નવલકથાએ એમને અઢળક કીર્તિ અપાવી પણ કવિતા અને નાટક માટે નાનપણથી અઢળક પ્રેમ.. એમના સર્જનની શરૂઆત કવિતાથી થઈ. ૧૪-૧૫ની વયે રફ્ફેલી એક પંક્તિ ‘કુમાર’માં સુભાષિત તરીકે છપાયેલી –

‘ખીલતા કુલને કદીયે ખ્લાન મેં દીહું નથી..’

સુભાષિત સમી અનેક પંક્તિઓ એમનાં કાચ્યોમાંથી સાંપડે. ક્યારેક શીર્ષક પણ સુભાષિત જેવાં મળે. જેમકે – ‘માને તો માયા એ જ મોક્ષ’ ! સુભાષિત સમી પંક્તિઓમાંથી થોડાં ઉદાહરણ –

‘વેદના મળી, મને મારાથી મોહું દઈ જડયું.

હું કેડી ખોતાં શતપથમાં પ્રસર્યો,

ફેલાયો ઈમારતોના, રસ્તાઓના, આકાશોના અવકાશો.’

(જોયું ? દઈ એમને ક્યાં ક્યાં લઈ ગયું ??)

\*

‘મારુ અસ્તિત્વને વેદનાનું ઋત !’

\*

‘હું પૃથ્વીનો અંકુર મુગધ, ઊંચાં  
આકાશતત્ત્વો નીરખી પ્રકુલ્લ !’

\*

‘આ દઈ મૌનમાં જ છવાતું ભવે હવે,  
મેં તો કહ્યું હતું મને ને સાંભળ્યું તમે.’

\*

‘અને કાંચાઓનો બાધ નથી,  
સંસાર જેટલો જ ગમે છે બાવળ.’

\*

‘શ્રદ્ધા તારી સ્વર્ણ પ્રભુ છે.’

(જોયું ? – આ સર્જકમાં કયારેક સીધાં વિધાન પણ મુક્તકની જેમ ચમકી રહે  
છે !)

\*

‘ક્ષાણકણ બને પર્વ — એ જ જીવનનો મર્મ !’

\*

‘ભુક્તિ હોય ના સ્નેહવિહોષી !’

\*

‘સુંદરતાની માળના મેરુને આપું માન,  
શૌર્ય પણ સંયત હોવું ઘટે એટલું ભાન.’

\*

‘એકકી તોય સૂનો ના લાગતો માર્ગ પૂર્વનો,  
યુગોનો વારસો ગતાં વૃક્ષને સ્પર્શ સૂર્યનો.’

\*

‘સામા પૂરે વિકટ તરંગે  
સારાપ સાથે સરવું.’

\*

‘વિશ્વને નીડ માનો તો સંભવે કૃતિ સંસ્કૃતિ.’

\*

‘કહું છું સર્વ શાસ્ત્રોની પરકમ્મા પૂરી કરી :  
ચાહતું એટલે હોવું – એ જ આસ્તિત્વની ધરી..’

સુભાષિત સમી તેજભરી દિલ્લિ ઉપરાંત સંવેદન તથા કલ્યન પણ એમની કવિતાના  
મૂળમાં ધબકતાં રહ્યાં છે. ‘માને તો માયા એ જ મોક્ષ’ કાવ્યમાંથી એક ઉદાહરણ ટાંકું –  
‘ચિતાની યાદી વાળવા ગયો  
ત્યારે સૂર્યોદય થવામાં હતો.  
માનાં કૂલ જાણો મને ઓળખતાં હોય  
એમ દુધિયલ આંસુ-શાં ચમકી ઉક્યાં..’

સંવેદન, કલ્યાન, વિચાર, દસ્તિ, મૂળ માટી, વૃક્ષો, જેતર, પ્રકૃતિ, સંસ્કૃતિ... બધું એમની કવિતામાં સતત ધબકું રહ્યું છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તમસા’ ૧૯૬૭ માં પ્રગટ થયો. ત્યારપછી ‘વહેતાં વૃક્ષ પવનમાં’, ‘કૂટપાથ અને શોઢો’, ‘પાદરનાં પંખી’, દીર્ઘકાવ્ય ‘બચાવનામું’ આદિ સંગ્રહો પ્રગટ થયા. ‘મને કેમ ના વાર્યો?’, ‘રાજસ્થાન’, ‘કેફિયત’, ‘આ એક નદી’, ‘જુગજુગના જીવણ’, ‘દઈ’, ‘એકલતા’, ‘વહેતાં વૃક્ષ પવનમાં’, ‘પંખી’, ‘તું વરસે છે ત્યારે’, ‘ક્યારા વાળું ને’, ‘માને તો માયા એ જ મોક્ષ’, ‘કૂટપાથ અને શોઢો’, ‘પાદરનાં પંખી’, ‘ધરાધામ’ જેવાં સંવેદન તથા ઐતિહાસિક-સાંસ્કૃતિક ઊંડાશ અને વ્યાપ ધરાવતાં, એમના વિલક્ષણ કવિક્રમ – કવિધર્મનો પરિચય કરાવતાં કાવ્યો એમની પાસેથી મળ્યાં છે. છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ, મુક્તક, દીર્ઘકાવ્ય, સોનેટ જેવાં વિવિધ સ્વરૂપોમાં એમણે કામ કર્યું છે.

ગદ્યમાં તો એમની કલમ થાક્યા વિના, વિસામા વગર સતત ચાલતી રહી છે. જોકે, નવલકથા અંગેની કેફિયત આપતાં એમણે કબૂલયું છે – ‘અતિલેખનનો ભાર અનુભવાય છે.’ કેફિયતમાં એમણે નોંધ્યું છે તેમ, માત્ર શબ્દ નહીં, જીવન પણ એમની નવલકથાનું માધ્યમ રહ્યું છે, તેમની નવલકથામાં – શબ્દ અને સમાજનો સહયોગ રહ્યો છે. પાત્રાલેખન તેમના રસનું કેન્દ્ર રહ્યું છે, એમની મોટા ભાગની નવલકથાઓમાં પાત્ર એ મહત્ત્વનો આધાર રહ્યો છે. પરિષદ્-પ્રમુખ તરીકે એમણે ‘સર્જનમાં પાત્રની ભૂમિકા’ વિશે વ્યાખ્યાન આપેલું. પાત્ર, સંવેદન, અનુભવની શક્તિ, સાંસ્કૃતિક ઈતિહાસ, જીવન પ્રત્યેની દસ્તિ આદિ થકી એમની નવલકથાનો શબ્દ આગવા સૌંદર્યથી ઝણહળે છે.

એમની પ્રથમ નવલકથા ‘પૂર્વરાગ’ ૧૯૬૪માં પ્રગટ થઈ. એની નોખી ભાષા અને તાજગી સહુને સ્પર્શ. ૧૯૬૫માં ‘અમૃતા’ પ્રગટ થઈ. ‘અમૃતા’ તથા ‘ઉપરવાસ’ ત્રયી તેમની સીમાચિહ્નરૂપ ગણાઈ છે. ધીરેન્દ્ર મહેતાએ નોંધ્યું છે તેમ, ‘અમૃતા’માં ‘વૈયક્તિક મૂલ્યોને અસ્તિત્વવાદી તેમ જ ભારતીય દર્શનના પ્રકાશમાં અભિવ્યક્તિ મળી છે.’ ‘વતનની આત્મકથા’ સમી ‘ઉપરવાસ’ ત્રયીમાં એમના અનુભવની અને શબ્દની શક્તિ પૂરી મોકલાશથી ઉંઘાડ પામી છે. પાત્રો, સમાજ, વતનનો પરિવેશ આદિના આધાર સાથે એમાં આશરે પાંચમા દાયકાથી સાતમા દાયકા સુધીના સમયનાં દસ્તાવેજ ચિત્રો પણ સાંપડે છે. સંસ્કૃતિ-સંદર્ભ તથા એમાંથી પ્રગટનું દર્શન આ કથાત્રયીને ‘ભારતીય’ નવલકથા, ‘એશિયન નોરેલ’ બનાવે છે.

‘ગોકુળ-મથુરા-દ્વારકા’ તથા ‘સોમતીર્થ’ સમી પૌરાણિક-ઐતિહાસિક નવલકથાઓ, સાંસ્કૃતિક ઈતિહાસ તથા સ્થાપત્યના અભ્યાસયુક્ત કથા ‘રૂદમહાલય’, નાટક તથા ચલચિત્રની ક્ષમતા ધરાવતી ‘લાગણી’, કટાક્ષકથા ‘એકલબ્ય’ તથા અન્ય નવલકથાઓ એમની પાસેથી મળી છે.

અનિયારેક વાર્તાસંગ્રહો પણ એમની પાસેથી મળ્યા છે. એમની વાર્તાઓના કેન્દ્રમાં સંવેદન, મનુષ્યજીવનની પરિસ્થિતિ – અનિશ્ચિતતા તથા સંબંધોની સંકુલતા રહ્યાં છે.

‘પોટકુ’, ‘ઉડ ગયે કુલવા...’, ‘નાણજાતક’, ‘પૂર્ણ સત્ય’, ‘પક્ષ-ધાત’, ‘ચિતા’, ‘તમ્મર’, ‘સાંકળ’, ‘એક સુખી કુટુંબની વાત’, ‘ચિત્ર’, ‘વાનપ્રસ્થ’ જેવી વૈવિધ્યસભર વાર્તાઓ એમની પાસેથી મળી છે. સહજ પ્રતીક, કલ્પન, જરૂર પડ્યે કાબ્યતત્ત્વ, તળપદી બોલી, ઉત્કૃષ્ટ સંવાદ, પાત્રો, પરિસ્થિતિ, પરિવેશ આદિનો વાર્તામાં વિનિયોગ કરીને તેઓ સામગ્રી અને સ્વરૂપનું સંતુલન સાધે છે.

‘અશોકવન’, ‘જૂલતા મિનારા’, ‘સિક્કિદર સાની’, ‘નજીક’ જેવાં નાટકો એમની પાસેથી મળ્યાં છે. પ્રસિદ્ધ દિંગદર્શકો તથા કલાકારો દ્વારા એ નાટકોનાં સફળ મંચન પણ થયાં છે. ‘દિમલાઈટ’ તથા ‘નીજે પુરુષ’ જેવા એકાંકીસંગ્રહ પણ એમણે આપ્યા છે. કલાસિક એકાંકી ‘દિમલાઈટ’ અનેક વાર સફળતાપૂર્વક ભજવાતું રહ્યું છે.

આસ્વાદલક્ષી વિવેચન, નિબંધ, પ્રવાસ, હાસ્ય, અનુવાદ, સંપાદન, બાલ-સાહિત્ય આદિ ક્ષેત્રે પણ એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ‘સહરાની ભવ્યતા’, ‘તિલક કરે રઘુવીર ૧-૨’, ‘માનસથી લોકમાનસ’માં સાહિત્ય, સમાજ, અધ્યાત્મ આદિ ક્ષેત્રે પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં ચિત્રચિત્રણ સાંપદે છે. લેખનની સાથે તેમણે સંકુલ-સક્લ સંસારને જોવા-સમજવાનું સતત ચાલુ રાખ્યું છે.

નિવૃત્ત પછી તેઓ વધારે પ્રવૃત્ત થયા છે. એમને ખૂબ ગમતું કામ – વતન બાપુપુરામાં સમય ગાળવો – ખેતરમાં કામ કરવું... (‘તમસા’નું એક મુક્તક યાદ આવે છે : ‘મેં ખેતરમાં મન વાયું/ને ઊગી આવ્યું નગર.’) પરિષદ્ધના ટ્રસ્ટી તથા અધ્યક્ષ તરીકેનાં કામો તો સતત ચાલે. એ ઉપરાંત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ (સણોસરા), ગ્રામભારતી (ગાંધીનગર) આદિ સંસ્થાઓના ટ્રસ્ટી તથા આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિના ટ્રસ્ટી તથા અધ્યક્ષ તરીકે પણ તેમની સેવા મળતી રહી છે. નિવૃત્તિ બાદ એમણે શરૂ કરેલ ‘રંગદ્વાર’ થકી તેઓ પ્રકાશનનાં કામો પણ સતત કરતા રહ્યા છે.

‘કુમાર ચંદ્રક’ (૧૯૬૫), ‘અમૃતા’ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પુરસ્કાર, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘ઉપરવાસ’ કથાત્રયી માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર, ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા હિન્દી ભાષામાં યોગદાન માટે સૌભાગ્ય સન્માન, ‘દર્શક’ એવોઈ, ગુજરાત સાહિત્ય અકાદેમી દ્વારા ગૌરવ પુરસ્કાર આદિ સન્માન એમને પ્રાપ્ત થયાં છે. દિલ્હી અકાદેમી દ્વારા ફેલોશિપ ગૌરવ માટે રઘુવીરભાઈને ખૂબ ખૂબ અભિનંદન.

૧૮-૮-૨૦૧૩

– યોગેશ જોણી

ચાર કાવ્યો | ચંદકાન્ત શેઠ

૧. ખાર જળમાં કેમ રાખતો ?

ખાર જળમાં મને દૂલાડુલ કેમ રાખતો રામ ?  
ચરણ કળજમાં બૂધે એવા જેલ રચે શું કામ ?  
કાંટા વેઠચા, વાડો વેઢી, બંધિયાર ઘર વેઠચાં;  
તરાં શિખરો નહીં પમાયાં, પડ્યા ખીશમાં હેઠા !  
બપોરનો થૈ સૂરજ, મારું કેમ ધખારે ધામ ?  
મીંહું લીંસે મૌન ભીતરને, લોચન ઘન ઘેરતાં;  
એક વીંધાયા પારેવાનાં પિચ્છ ઘટે ઘૂમરતાં !  
પુષ્પો પથ્થર થઈ દૂલતાં ચીધે મારું નામ !

૨. જૂઠી મારી જબાન હો ના

જૂઠી મારી જબાન હો ના;  
ગાજવીજનું ગુમાન હો ના.  
હળવે હળવે ઝરમર ઝમતું,  
નરી નજાકત આગળ નમતું,  
રમતા રહીને સૌને ગમતું,  
ઉમલૂમ જે આવે એને કાજ કશ્યુંયે અજાણ હો ના -

સુંદરતાના ઢળે ઢળતું,  
મનના મેળે સૌને મળતું,  
ભીતરની ભરતીમાં ભળતું,  
ધ્યુવને જોતી નાવ ધસે તો આંકુંઅવળું સુકાન હો ના -  
લીલપની લેણોમાં લળતું,  
મૂળમાં રહીને ફૂલમાં ફળતું,  
મધુમયતાશી મનમાં ગળતું,  
અંદર જ્યારે ટહુકો ઉઠે પાન ખર્યાનું તુલન હો ના -

### ૩. તો જાણ્યું છે ?

અંસુનું જે રૂપ, તમે જાણ્યું છે ?  
કુંખનું કેવું સુખ, તમે માણ્યું છે ?

ખારા જળનો દરિયો એનો કેવો ભવ્ય ઉભાર !  
તરસ્યા રણમાં તવ્યા તાપની કેવો કરે ઝગાર !  
રેતીકષ્ણ પર બંધાતા મોતીનું મન જાણ્યું છે ?  
ઠેકર ખાતાં ફરનારાનું અમણ તમે માણ્યું છે ? -

છાતી હંદે, પગ થાકે, પણ ટોચે એમ ચડાતું;  
દંખ વેઠતાં મધમાખીનું મધ જે અસલ, ચખાતું;  
બળતાંયે દે ઉજાશ, એનું મૂળ તમે જાણ્યું છે ?  
કંટે કંટે લિલાય આકળકૂલ, તમે માણ્યું છે ? -

### ૪. શું કરવાનું ?

તમને મારો પડધાયો જો વાગે, શું કરવાનું ?  
તમને મારું પગલું પાગલ લાગે, શું કરવાનું ?

રસ્તો જેવો એવી મારી ચાલ,  
હવા હાલની જેવી એવા હાલ;  
હોય તમારી પાસે ખોંચી જો રૂહેવાનું આદે, શું કરવાનું ? -

જેવો દીવો એવો રહે ઉજાશ,  
જેવો માળો એવો રહે નિવાસ;  
માંડ વાદળી મળી, મોકલી, વણવરસી જો ભાગે, શું કરવાનું ? -

જેવી મેદી એવી ચડે રતાશ,  
શબ્દો જેવા એવા ઢળતા પ્રાસ;  
જંતરના જે તાર મેળબ્યા, બસૂર થઈ જો વાગે, શું કરવાનું ?  
સવાર થઈ આવો ને મારું ભીતર જો ના જાગે, શું કરવાનું ? -

## બે કાવ્યો || ધીરુ પરીખ

### ૧. પરિ અને હરિ

નાનો હતો ત્યારે  
સાંભળતો હતો વાતરીઓ પરીની નરી.  
અને આનંદ આનંદ છાઈ જતો  
મન અને મગજને ભરી :  
પરીઓની સાથે બસ ક્યાંનો ક્યાંય જતો સરી !

પાછો વયના વધવા સાથે  
પટકાયો પરીના પ્રદેશમાંથી  
ક્યાંયનો ક્યાંય; જાણું નહીં કે  
હવે મારે રહેવાનું કોની તે સંગપાયે !

અને ત્યાં તો આવી ખોંચ્યા હરિ.  
લે, આ તો કે વાત થઈ ભરી.  
'ભજ ગોરિંદમ્ય ભજ ગોરિંદમ્ય'  
જિલ્લવા રટે ફરી ફરી  
આમ છતાં થયા કરે :  
ક્યાં ગઈ એ પરી ?  
લાગે છે કે તેને હરિ ગયા હરી.  
પરી અને હરિ...  
બંનેએ આયુના આરંભ ને અંત સુધી  
જીવનને જાણવા ના દીધું જરી.

### ૨. ખોતરવું-જોતરવું

યુગોથી ખોતરાવું પડે છે આ ભૂમિને.  
માનવજાત, ના ના; જીવમાત્રના  
ઉદરભરણ માટે.

જોતરાવું પડે છે ધોરી-ઊંટ ને અશ્વને  
માત્ર નિજ કાજે નહીં  
સર્વની કૃધાને સંતોષવા.  
એકલું ખોતરાવાથી

યા તો એકલું જોતરાવાથી  
 ક્ષુધાનું શમન થતું નથી  
 ક્યાંય ને ક્યારેય પક્ષા -  
 આટલું જો સમજાઈ જાય  
 તો હુંઘી ના રહે કોઈ જણ !

---

## પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

- <sup>1</sup> 15750 'પરબ' દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.  
<sup>1</sup> 15750 'પરબ'ના ગ્રાહક તથા પરિષદના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.  
<sup>1</sup> 15750 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦ છે.  
<sup>1</sup> 15750 વિદ્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ રૂ. ૭૫ છે. સાથે પ્રમાણપત્ર બીડવું.  
<sup>1</sup> 15750 ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજીવન સભ્યપદના શુલ્કમાં 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.
- <sup>1</sup> 15750 પરિષદના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુલ્ક રૂ. ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક રૂ. ૩૦૦ છે.
- <sup>1</sup> 15750 પરિષદના આજીવન સભ્યપદનું શુલ્ક રૂ. ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સભ્ય ફી રૂ. ૩,૦૦૦ છે. (વિદેશશાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)
- <sup>1</sup> 15750 'પરબ' લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ રાફટથી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.

લેખકોને :

- <sup>1</sup> 15750 'પરબ'માં પ્રગટ થતાં લખાશોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.
- <sup>1</sup> 15750 લેખકોએ પોતાનું લખાશ ફૂલચકેપ અથવા ડાઢ સાઈઝના કાગળની એક બાજુએ, સુવાચ્ય અસ્કરે લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઇનલોન્ડ કે ચબરખીઓમાં ફૂતિ મોકલવી નહીં. પ્રત્યેક ફૂતિ નીચે પૂરું સરનામું લખવું તથા એક નકલ પોતાની પાસે રાખીને જ ફૂતિઓ મોકલવા વિનંતી.
- <sup>1</sup> 15750 ફૂતિની જાણ કરાશો. ટાલ-ટિકિટો ચોંટાદેલું કવર મોકલ્યું હશે તો અસ્વીકૃત ફૂતિ પરત કરવામાં આવશો, અન્યથા ફૂતિ અસ્વીકૃત ગણવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતની જાણ કરાશો.
- <sup>1</sup> 15750 મત્રવ્યવહારનું સરનામું : તંત્રી, 'પરબ', ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'થાઈમ્સ' પાછળ, નાદીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

## સમીક્ષા-ગ્રંથાવલોકન

ગ્રામજગતનું યથાતથ વાર્તિક : ‘નોળવેલ’ | નવનીત જાની

[‘નોળવેલ’ : ગોરધન ભેસાણિયા, પ્ર.આ. ૨૦૧૦, પ્ર. ગુ. સા. પરિષદ, પૃ. ૧૪+૧૨૬, કિ. ૩. ૮૦/-]

‘નોળવેલ’ ગોરધન ભેસાણિયાનો ચોથો વાર્તાસંગ્રહ છે. અગાઉ એમની પાસેથી ‘આભલું’ (૧૯૯૮), ‘જીવતરનું લૂણ’ (૨૦૦૫) અને ‘પાદરને પીપળે’ (૨૦૦૬) જેવા વાર્તાસંગ્રહો પ્રાપ્ત થયા છે. ‘એક તણખલાની વાત’ (૨૦૦૭) એમની પુરસ્કૃત નવલકથા છે.

ઓછો અભ્યાસ અને નિતાંત ગ્રામજગત ધરાવતા લેખકનો રચનાલોક રૂઢ હોય એટલો નિજ સંદર્ભે ગાઢ પણ હોવાનો. હિલચોરીને કોરણો મૂકીને હૈયામાં ઊંઘું એને આલેખવાનું આ વાર્તાકારને વધુ માફક આવ્યું છે. જે લખાયું એને આશ્ર્યની આંખે જોવા જેટલું ગોરધનભાઈ અંતર પણ જાળવી શક્યા છે. સંગ્રહની તેવીસ વાર્તાઓમાં, સૌરાષ્ટ્રનો તળપ્રદેશ એનાં ચરિત્રો, પરિવેશ, બોલી અને સ્થિતિગતિને લઈ જડતરની જેમ જળવાયો લાગે છે.

‘સિંદોર’માં બહુ બોલકી પ્રથમ પત્નીને છોરીને ભવાન બીજ પત્ની લાવ્યો તો એ સાચ અખોલી નીકળી ! આ અસંતોષમાંથી ઊરી નીકળે છે પ્રથમ પત્ની સાથેના ખટમીઠા પ્રસંગોની યાદ. પ્રથમ પત્ની બોલકી હતી. એ જ સ્વભાવ જમનાને ભારે પડે છે. રીસામણાં-મનામણાંથી રણકતો સંસાર ભવાનની વહેમયુક્ત વાણીથી છિન્નભિન્ન થાય છે. બંનેને પોતાનો ઉતાવળિયો નિર્ણય સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ઘણા સમયે શહેરના બસસ્ટેન્ડમાં જોયેલી જમના, ભવાનને હાડપિંજર જેવી લાગે છે. એક સમયે આ બોલકી બાયરીને સિંદૂર પાઈ દેવાનું વિચારતો ભવાન એના સેંથામાં સિંદૂર જોઈન અંતર અનુભવે છે. છતાં લાગણીની લીલાશ એવી કે એને થાય છે : ‘શું ફરક પડે છે... સિંદોર સેંથીમાં હોય કે પછી...’ જમનાના બદલાયેલા વ્યક્તિત્વથી પીડા અનુભવતો ભવાન, જમનાના વર્તમાન દાખ્યત્વનેય કળી જાય છે. સ્ત્રી-પુરુષના અકળ મનની આ વાર્તા ઠીક કળાત્મક અભિવ્યક્તિ પામી છે.

સુખી અને સગવડવાળા હોવા છતાં નીરણની ચોરી કરતા ભવાનબાપાના પ્રાણીવત્સલ હૃદયનો પરિચય ‘ઉંઘાડા માથે’માં થાય છે. વીરજીભાઈની સારી ગુણવત્તાવાળી નીરણચોરી પોતાના બળદોનો કોઠો ટાઢો કરતા ભવાનબાપા ગામફઝેતીની સાથે ગામનો સમભાવ પણ મેળવી જાય છે. વાર્તાકારે રહસ્યાત્મક ઢેબે વાર્તાકહેણી માંડી છે એ આ વાર્તાનો આસ્વાદ અંશ છે.

‘અવળાં પાડી’ માંગલ્યકથા છે. બાપ દીકરીઓને પરણાવે એને કન્યાદાન કહેવાયું છે. અહીં દીકરીઓ બાપને પરણાવીને એના ઓશિયાળાપણામાં માંગલ્યનું સિચન કરે છે. આશા-ઉધાની સમજ બાપ માધાની સમજથી ચિહ્નાતી સાબિત થાય છે. લેખકે વાર્તાપીક્ષિત સંઘર્ષની સુક્ષ્મતામાં પડ્યા વિના સીધો-સોસરો માર્ગ પસંદ કર્યો છે.

‘ભોટ’ વાર્તામાં ઘર છોડીને અન્ય સાથે ભાગી ગયેલી પત્નીને પોતાનાં નાનાં બાળકો ખાતર લાવવાની જીદે ચઢેલો મનસુખ ભોટમાં ખપે છે. આવનારીનાં અનેક જોખમો અને સમાજમાં બેઆબરુ થવાની શક્યતાને અવગણી મનસુખ પોતાની વાતે વળગી રહે છે. એમાં એની બાળ-પરવા અને સહિષ્ણુ સ્વભાવની જાંખી થાય છે.

સંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી કિરીટ દૂધાતે યોગ્ય કહ્યું છે કે, “ગ્રામ્યજીવનનાં બધાં પાસાંઓ ઉપર એમની કલમ સમભાવપૂર્વક ચાલે છે.” અહીં મોટા ભાગની વાર્તાઓ ગુજરાતમાં પંચાયતી-રાજ આવ્યું એ સમય આસપાસની છે. તત્કાલીન ગામડાંની બદી-ખૂબીને વાર્તાકારે આપડી સામે યથાત્થ મૂકી આપી છે. એ ગામડાથી વિચ્છેદ પામેલા કે શહેરમાં રહીને અતીત ચિત્રો આદેખતા લેખક નથી. એથી એમનાં ગ્રામચરિકોમાં નરી સર્વ્યાઈ વર્તાય છે. કુવારી દીકરીને ગર્ભ રહી જતાં પરિવારના વિરોધ વચ્ચે દીકરીની પૂર્ણ રહેતો ‘નમાલો’, બેકારીના સમયમાં દાડાપાણીનો જોગ ન કરી શકનાર ‘ધારું’નું દંપતી, આઝાદી પછીય અસ્પૃશ્યતાના ધોરણે વ્યવહાર કરતો ગ્રામસમાજ (‘આભડઠેટ’) ગોરધનભાઈની નજરે યથાર્થ રૂપ પામ્યાં છે.

અહીં વરવી વાસ્તવિકતા ધરાવતી બે વાર્તાઓ ઉપર ધ્યાન દોરું ? ‘ધારું’માંની ભૂરાની વહુ અને ‘શોઢો’ વાર્તાનો ગીગન એમનાં અવળાં પગલાં દ્વારા આપણાને હતપ્રદ કરી દે છે.

ચારિન્ય ઉપરના ખોટા આળને કારણે ભૂરાની વહુ અજિનસનાન કરે એમાં અગાઉ એ અજિનસનાનથી બચી ગયેલી એ ઘટનાનો ઓથાર પડેલો છે. પહેલી વાર એ અકસ્માતે જીવન પાસે છે. પણ આળ-ચડ્યા જીવનથી છુટકારો પામવા એ પુનઃ અજિનસનાન કરે છે. એના સસરાનું ઘરમાં એકલા હોવું અને સાસુનું પાદર જવું એ સહજ અકસ્માત એને ચારિન્યની કસોટીએ ચાડાવે ને સ્વમાન જાળવવા એ મૃત્યુ પસંદ કરે છે.

ગીગન કર્કશા પત્નીના સ્વભાવને કારણે રાજી સાથે આડા સંબંધી બંધાય છે. એમાં પુરુષવૃત્તિનો વિજય વધુ છે. ગીગનનું પુરુષત્વ એને જુદા માર્ગે લઈ જાય છે. એમાં રાજ્ઞાનાં ઈજનોનો ફાળોય ઘણો છે. અહીં માત્ર ગીગનની પત્નીનો સ્વભાવ જ ‘કારણ’ નથી બનતો.

‘તમારે પરતાપે’માં લેખકે ઘણી સંયત કલમે પોતા વળંદની કરુણકથા આદેખી છે. રાવતુબાપુના ચાકર તરીકે ખાવા-પીવાનું પામતો પોલો બાપુનાં વળતાં પાણી થતાં આશ્રય ગુમાવે છે. આશ્રિક રીતે મોટે ભાગે રાવતુબાપુનો ઓશિયાળો રહેલો પોલો બીમાર

પુત્રની સારવાર પણ કરવા સમર્થ નથી. રચતુબાપુ પાસે હવે આપવા જેવું કરું નથી. સામંતશાહીની ભાંગતી દશાએ એની સાથે જોડાયેલા વસવાયાઓનેય કેટલા લાચાર કરી દીધા હતા એનું ગંભીર ચિત્ર આ વાર્તામાં સાંપડે છે. ‘તમારે પરતાપે...’નું પુનરાવર્તન બાપુ અને પોલા પક્ષે જેટલું મર્મણું લાગે છે એથી વધુ કરુણાસભર ઠરે છે. વાર્તા આપણા મન પર પીડાનો ભાર લાઈ જાય એવી સચોટ બની છે.

લોકભાષાની પ્રોઢી સામાન્ય ગ્રામચિત્રને કેટલું નોંધું તારવી આપતી હોય છે એ સમજવાય ગોરધન બેસાણિયાની વાર્તા વાંચવી રહી. એ માત્ર ગ્રામવાસી નથી, ગ્રામલોકવાસીય છે. લોક વચ્ચે એમનામાંના જ એક બની રહ્યા છે એની પ્રતીતિ ગામડાની મૂળભૂત સમસ્યાના આવેખનમાં મળે છે. ગોરધનભાઈએ સંવાદો પાસેથી ખાસું કામ લીધું છે. માનવવૃત્તિ, માનવવર્તનનાં કેટલાંય સૂક્ષ્મ પાસાં સંવાદો દ્વારા ઉદ્ઘાંય છે. લેખકની કોઈસૂઝ એમનાં પાત્રોમાંય અનાયાસ ઉત્તરી આવી છે. જુઓ : ‘નવી બાઈ કેવી આવે ઈ કોણે ખબર ? ને જે આવે ઈ એના ઓરતા લઈને આવે ન ?’ ‘અવળાં પાણી’ વાર્તાનો માધ્યો નવી પત્ની ન લાવવાના કારણમાં કહે છે, એ કેટલું સાચું છે !

એમની વાર્તાઓમાં કેટલી ઉપમા-ઉત્પેક્ષાઓ માત્ર અલંકાર ન રહેતાં કાર્યવેગનેય બળ આપે છે.

– ‘ગામની ડેશીઓ ખેતર વચ્ચે બાજરાના ઓધા માંડ્યા હોય તેમ બજાર વચ્ચે ઊભા રહી એકબીજાની સામે જોઈને મર્મણું હસ્તી.’ (‘ડાધ’)

– ‘કૂતરાના કંવકારે તો જાણે આજો ચોરો જ બેઠો થઈ ગયો.’ (ચોરાની પાળે)

આ ઉપરાંત, ‘લાપસી ફાકતાં મોઢાં’, ‘લોંકડી ખાંપે ચડવી’, ‘કૂલ ફરકવા ન ઢેવું’, ‘ગાજના આંકાની ખબર ન પડવી’, ‘ધજાગરો બાંધવો’, ‘મેથીપાક મળવો’ જેવા રૂઢિપ્રોગ્રામો અને ‘મેભૂર’ (ભરચુક), ‘ઝીહર્ય’ (મકરસંકન્તિ), ‘કડાકડી’ (અછિત), ‘ઉડવાણ’ (સુકારો), ‘કઠોડો’ (ગાડું), ‘ગવેહ’ (અણસાર) જેવા લોકબોલીના શબ્દો તળભાષાસૂચિ વચ્ચે આપણને મૂકી આપે છે. આવા શબ્દોનું એક દસ્તાવેજ મૂલ્ય હોય છે. લોકબોલીનો શબ્દકોશ બનાવનારે આ વાર્તાઓ જોવી રહી.

સીમનાં અને રાત્રિનાં એકાધિક ચિત્રો એમની વાર્તામાં અંકાયાં છે. એ વર્ણન પણ ખાસું ઈન્ડિયગ્રાહ્ય બન્યું છે. ‘નમાલો’, ‘નોળવેલ’, ‘ચોરાની પાળે’, ‘સિંદોર’ જેવી વાર્તાઓમાં લેખકની સૂક્ષ્મ નિરીક્ષણદિષ્ટિનાં દર્શન થાય છે. ‘નોળવેલ’માં તો સીમની વનસ્પતિને લેખકે જીભના ટેરવે મૂકી આપી આપણી રસેન્ડ્રિયોને વિભોર કરી દીધી છે. આંબલીનો કોલ, કાતરાં, પીપરની પેપડી, લીંબડાની લીંબોળી, ઉમરાના પેપા, ખરખોડીના સુડિયા ને ગણગોટા, રામભાણની શિંગો, ઝીજડીના હંગડુ, કેવડા, આંકોલા, કટગુંદીનાં ગુંદાં, કુંદેર, હાથલિયા થોરના ડોડવા, રાવણાં-રાયણાં, ઘઉંનો પોંક, ચયણાનો ઓળો, શેરડી, શક્કરિયાં, મગફળી, મકાઈડોડા, ચીભડાં, મગ-મઠની શિંગો... અભરેભરી

ખાદ્યસૃષ્ટિ આ પૂર્વ મેઘાણીની કેટલીક લોકવાર્તાઓમાં આવેખાઈ છે. બીજુ કદાચ ગોરધનભાઈની વાર્તાઓમાં.

‘રખોપિયો’ વાર્તામાં પ્રેતસૃષ્ટિનું રોમાંચક આવેખન સત્ય કરી દે એવું બન્નું છે. વાર્તાઓ વાંચતાં લેખકની રચનારીતિ અસાહસ્રિક લાગે, પણ સપાટ બહુ ઓછાને લાગશે. જમીન પર અત્રતત્ર વિહરવાને બદલે યોગ્ય જગ્યા શોધી કૂવો ગાળવાનું ગોરધનભાઈની વાર્તાપ્રકૃતિ છે. પરિશ્રમથી ભરપૂર ખેતીકામ સાથે જોડાયેલા આ વાર્તાકારનું અનુભવવિશ્વ ભલે સીમિત લાગનું, વાર્તાઓ એમના અનુભવવિશ્વના અત્યાર ઊંડાણનો ખ્યાલ આપે જ છે. એમની વાર્તાઓ તળનો ધબકાર છે, હા, ગ્રામજગતનું યથાતથ વાર્તિક છે.

## ગાંધીની વીરપસલી | દક્ષા વી. પણેશી

[‘ગાંધીની વીરપસલી’ : ગાંધીજીના બહેનો પર લખાયેલા પત્રોનું સંપાદન : સંપાદિકા : શ્રીમતી ભદ્રાબહેન સવાઈ, પ્રકાશન : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, પ્ર. આ. ૨૦૦૮, ડિ. રૂ. ૨૫૦/-]

ગાંધીસાહિત્યના સંપાદનગ્રંથો, ગાંધીજીનો અક્ષરદેહ, કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી, કાલેક્ટકરનું પુસ્તક ‘આશ્રમની બહેનોને બાપુના પત્રો’ વગેરે ગ્રંથોમાંથી સંપાદિત કરેલા કુલ પાંચસૌ બાણ્ણ (૫૮૨) પત્રોનો આ સંચય છે અને એ પણ ગાંધીજીએ ફક્ત બહેનો પર લખેલા પત્રો છે એથી શ્રી નારાયણભાઈ દેસાઈએ ‘ગાંધીની વીરપસલી’ એવું ભાવપૂર્ણ શીર્ષક આપ્યું છે.

સંપાદનમાં આ પત્રોને કુલ ચૌદ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે પરંતુ (એ વિભાજન દૂધપાણીને છૂટાં દેખાડવાં જેવું લાગે છે જેમ એક વાસણમાં રહેલા દૂધપાણીને છૂટાં પાડી શકતાં નથી તેમ ગાંધીના સાહિત્યને ક્યારેય સંપૂર્ણ અલગ એવા ખંડોમાં વહેંચી શકતું નથી આથી જ) સંપાદિકાએ સ્વીકાર્યું છે કે આ વિભાગો છતાં ઘણા પત્રો એવા છે જે એક કરતાં વધારે વિષયમાં ગોઈવાઈ શકે.

કોઈ પણ સંપાદનકાર્ય વિશે બે દિઝિબિન્ડુથી વિચારી શકાય. એક : મૂળ લખાણનું સત્ત્વ શું છે ? અને તેનું સ્વરૂપ કેવું છે અને બીજું : સંપાદનમાં સંપાદકનો અભિગમ, તેની કલાસૂજ અને તેની સાર્થકતા કેટલાં છે ?

ગાંધીવિચારના અભ્યાસીને સહેજે સમજાય એવી વાત એ છે કે ‘અન ટુ ધિસ લાસ્ટ’ છેલ્લામાં છેલ્લા માણસને નજર સમક્ષ રાખીને વિચારવું એ માત્ર આર્થિક વિચારણા પૂરતું મયર્દીટ નથી. ગાંધીજીએ જીવનના આરંભથી માંડી અંત સુધી માત્ર છેવાડાના નહીં, પહેલાથી છેલ્લા સુધીના સર્વને તેમાં આવરી લીધા છે. એમના સાહિત્યસર્જનમાં એમણે આ કામ પત્રો દ્વારા કર્યું છે. નાનામાં નાના માણસને તદ્દન સામાન્ય પ્રશ્નોના ઉત્તર આપવાનું એમણે ક્યારેય ટાળ્યું નથી. દુનિયામાં ભાગ્યે જ કોઈએ

આટલી સંખ્યામાં આટલા વિષયવૈવિધ્ય સાથે અને આટલા નિયમિત પત્રો લખ્યા હો. આ વિપુલ બંડારમાંથી માત્ર ગાંધીજીએ બહેનોને લખેલા પત્રોને એક ચોક્કસ દણ્ણિંદ્રિયુદ્ધી પરંદ કરી આ સંપાદનમાં લેવાયા છે. દેખીતી રીતે આ પત્રો બહેનો પર લખાયેલા છે પરંતુ એ તો નિયમિતમાત્ર છે. તેમાં નિરૂપાયેલ જીવન વિશેની સમજજ્ઞ કે દર્શન એ કોઈ પણ દેશના કોઈ પણ માનવીને કોઈ પણ કાળે માર્ગદર્શક બની રહે તેવું છે.

ગાંધીજીના જીવનનું અંતિમ લક્ષ્ય છે સત્યનો સાક્ષાત્કાર. એ માર્ગ જતાં એમને સત્યની જાંખીનો જે અનુભવ થયો તે અનુભવ બીજાને કરવાવાની વ્યાપક પ્રેમભાવનામાંથી એમણે સંકમજ્ઞાનાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કર્યો છે તેમાં આ પત્રો એ વિવિધ કાર્યો સાથે સંકળાયેલી બહેનો પર લખ્યા હોવા છતાં તેમાંથી પ્રગત થતું સારરૂપ તત્ત્વ તો આટલું જ છે કે વ્યાપક પ્રેમભાવની દણ્ણ કેળવી, નભ્રતાની સાધના દ્વારા આપણે સત્યદર્શનનો અનુભવ અથવા તો જીવનની સંવાદિતા, સમતા કરી રીતે પામી શકીએ.

બધા જ પત્રોમાંથી તરી આવતું આ સામાન્ય લક્ષ્ણ એ જેમ ગાંધીજીની વિશેષતા છે તેમ સંપાદનની પણ વિશેષતા છે. કેમ કે સંપાદિકા બહેને પત્રોમાંથી સ્થળકાળની સામાન્ય વિગતો ન લેતાં માત્ર ગાંધીજીના સત્યદર્શનના માર્ગને જ આવેખવાનું પરંદ કર્યું છે. આ ચોક્કસ અભિગમથી થયેલા સંપાદનને કારણે એ માત્ર બહેનો પરના જ હોવા છતાં શાંતિપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા ઈચ્છતા કોઈ પણ માનવીને માર્ગદર્શન પૂરું પાડે તેવા છે. તેમાં નિરૂપાયેલ દર્શન સ્થળકાળની મર્યાદાથી પર છે આથી આજે ભલે તે ગુજરાતીમાં હોય પણ અંગેજીમાં અનુવાદ થશે તો દુનિયાના લોકોને પણ માર્ગદર્શક થઈ રહે તેવું આ પુસ્તક છે.

પુસ્તકને અંતે આપેલ સંદર્ભસૂચી અને બહેનોના પરિચયની સૂચિથી શાસ્ત્રીય બનેલો આ ગ્રંથ અભ્યાસીને ઉપયોગી બની રહેશે.

પુસ્તકની સજાવટ પણ વિશિષ્ટ છે. આકર્ષક અને ફૂતિના સૌંદર્યને પોષક છે, પણ એ નજરે જોનાર પર છોડીને આપણે ફૂતિના હાઈ તરફ જઈએ.

પહેલો જ વિભાગ છે ઈશ્વર, એમની ઈશ્વરશ્રદ્ધામાં એક મનોવૈજ્ઞાનિક સમજ રહેલી છે. એ લખે છે.

“ઈશ્વરની દોરવણીમાં શ્રદ્ધા રાખનારાંઓ પોતાથી બનતું બધું કરી છૂટે છે અને પછી મગજ પર કશો ભાર રાખતાં નથી.”

પોતાના અનુભવના નિચોડ રૂપે એ લખે છે, “જ્યારે આપણે ખૂબ જ નિર્બળ બની જઈએ ત્યારે જો ઈશ્વર ઉપર ભરોસો રાખીએ તો તે આપણને એક યા બીજા પ્રકારે બળ આપે છે.”

ગાંધીજી ઈશ્વરની મદદને દુનિયાની અર્થથી જોતા નથી. એમની દણ્ણ તાત્ત્વિક અને

વિશેષ વૈજ્ઞાનિક છે. એ એક પત્રમાં સમજાવે છે, “આ દુનિયામાં એકલાં સુખો જ સુખો હોત તો આપણો જીવ એનાથી ઉબકાઈ જાય. દુઃખના પ્રાણવાયુ વિના આપણે મરી જઈએ.”

એ વ્યક્તિગત પ્રેમને વિસ્તારીને પરમતત્વમાં ઓળખવા કહે છે, “અંગત મિત્રતા એ અંતકાળ લગી ન જ રહે એ સ્વયંસિદ્ધ છે. તેથી તે મિત્રતાને ઈશ્વર સાથેની મિત્રતામાં હોમી હેવી. તેથી તેનો નાશ નથી થતો પણ તે વિસ્તૃત થાય છે, વિશુદ્ધ થાય છે.”

એ કયા કયા માર્ગે ઈશ્વરને ઓળખવાનું લખે છે? “આશ્રમમાં આપણે મૂર્તિ રાખતા નથી કેમ કે આપણી પાસે જગતરૂપી મૂર્તિ પરી છે તે વાટે ઈશ્વરને ઓળખિએ.”

એમની ઈશ્વરશ્રદ્ધા એકાંગી નથી. એ સ્પષ્ટ લખે છે, “ઈશ્વરકૃપા વિના પાંદડું નથી હાલંતું પણ પ્રયત્નરૂપી નિમિત્ત વિના પણ નહીં હાલે.”

એમનું આ કોર્સું તત્ત્વજ્ઞાન નથી. એ અનુભવના નિચોડ રૂપે લખાયું છે. ઈશ્વરકૃપા શું છે તે ઓળખવાની દસ્તિ આપે છે. એ લખે છે,

“મને એટલાં બધાં વરદાન મળ્યાં છે કે હું તો ગાણી પણ શકતો નથી કારણ કે એ જે કહેવાતાં દુંઘો અને શોકો મોકલે છે તે પણ વરદાન થઈને ઊતરે છે. આપણે જો એના પ્રેમને ઓળખતાં હોઈએ તો આપણને સમજાતું હોઈએ કે પોતાની સુષ્ટિ માટે એની પાસે વરદાન જ વરદાન છે, શાપ તો છે જ નહીં.”

એમનો અનુભવનો ઉદ્ઘાર જુઓ,

“હિવસો જાય છે તેમ તેમ એ જીવંત હસ્તીનો રોમરોમમાં અનુભવ કરતો જાઉં છું. એ વિના હું ગાંડો થઈ જાઉં. મારા ચિત્તની શાંતિમાં ખલેલ પહોંચાડે તેવી પાર વિનાની વસ્તુઓ હોય છે. એવી અનેક ઘટનાઓ બને છે જે જીવંત હસ્તીની પ્રતીતિ વિના મને પાયામાંથી હયમચાવી મૂકે. પણ એ બધું બાજુએથી પસાર થઈ જાય છે અને મારા પર તેની લગભગ કશી જ અસર થતી નથી. મારી જેમ તને પણ એવી પ્રતીતિ થાય એમ હું ઈચ્છાં છું.”

એક પત્રમાં એ સ્પષ્ટ લખે છે,

“તમને સુખ નથી ઈચ્છાતો પણ દુઃખને સુખ માનવાની શક્તિ ઈચ્છાં છું.”

આવા કંઈ-કેટલાયે પ્રયત્નો પણી તેમણે માત્ર આ દેશના નહીં, દુનિયાના માણસોને કષસહનમાં રહેલા આધ્યાત્મિક સુખનો અનુભવ કરાવ્યો છે.

પોતાને મળેલી વિવિધ સલાહો વચ્ચે પણ ગાંધીજીનો પોતાનો માર્ગ બહુ સ્પષ્ટ છે. એ લખે છે,

“હિમાલયમાં ભાગવું એ તો કાયરતા છે. માન-અપમાન સરખાં ગણવાનો પાઠ ગીતાને પાને પાને છે. કોઈ ગમે તે કહે તેનું દુઃખ ન હોય. અંતરાત્મા કહે તે વિચારવાનું હોય.” પણ આ અંતરાત્મા શું છે? “જો આપણું મન શુદ્ધ હોય અને આપણા દિલની

સર્વાઈની આપણને ખાતરી હોય તો એકમાત્ર વિશ્વસનીય માર્ગદર્શક તો અંતરાત્મા જ છે. આપણે ઘણી વાર આપણી જાતને જ છેતરતા હોઈએ છીએ.

વ્યક્તિગત સાધનાને લગતા વિભાગમાં સાધકને એમના આદેશો જુઓ ! “તમે જે શિખરે ચંડ્યાં છો, જ્યાં તમારા વિના બીજાને ઉભવાને તમે અવકાશ નથી રાખ્યો ત્યાંથી ઉત્તરવાની હું તમને સલાહ આપું છું.”

એક પત્રમાં લખે છે, “સત્યના પૂજારીની ઉપર પરિસ્થિતિની અસર ન થવી જોઈએ. તેણે તેને ભેટીને નીકળી જવાનું રહ્યું છે.”

“આપણે જેવા નથી તેવા દેખાવાનો ડોળ કરી ન કરીએ.” સેવા વિશે એ લખે છે,

“જેટલી સ્વાભાવિકતાથી આપણી આંખો પલકારા મારે છે એટલી જ સ્વાભાવિકતાથી આપણા હાથે સત્કાર્યો થવાં જોઈએ.”

“હું કામમાં જ પ્રભુને જોઈ શકું છું.”

‘‘ગુજરાતિકાસ’’ એ વિભાગના પત્રોમાં તો એમની અનુભૂતિની સર્વાઈનો રણકો જુઓ ! –

“જે તારામાં નહીં હોય તે તું લોકોને કરી આપી નહીં શકે.”

“આસપાસ હોળી બળતી હોય છતાં મનને શાંત રાખવામાં પણ કળા છે, સાધના છે.”

અદ્ભુત વિધાન તો આ છે. સરલાદેવી ચોધરાણીને એ લખે છે,

“મારા પ્રેમની કશી કિંમત નથી, જો તમારામાં રહેલું ઉત્તમ તત્ત્વ તે બહાર ન લાવી શકે. તમે આજે છો તે કરતાં તમને વધારે સારાં અને શુદ્ધ બનાવે.”

આ નિર્દોષ માણસનું સૃષ્ટિ સાથેનું તાદાત્મ્ય આ પત્રોમાં કેવું સાહજિકતાથી પ્રગટે છે ?! એ લખે છે,

“કૂલોને અને ઝડને મારા વતી બોલાવજે, એનાં ભાઈબહેનો અહીં પણ છે.”

આપણી વીરપસલીની વાર્તાની જેમ પેલા દુષ્કાળને કારણે અત્યંત ગરીબ ભાઈએ બહેનને પૂરા પ્રેમથી પોતા પાસે જે હતું તે માટીનું ઢેકું અને ગૌમૂરત્ર આપ્યાં અને આકાશમાં વાદળી જોઈ બહેને આશીર્વાદ આપ્યા કે વાદળી જઈને વરસજે મારા વીરના જેતરમાં. અને માટી ને ગૌમૂરત્રમાંથી લોટ, ગોળ-દી થયાં અને ભાઈનું ખેતર ધાન્યી લચી પડ્યું તેમ ગાંધીજીએ પોતાના જીવનના અનુભવના સારરૂપ સર્વસ્વ આ પત્રોમાં જગતની બહેનને આપ્યું છે કે કંઈ-કેટલાયનાં જીવન એનાથી સમૃદ્ધ, સાર્થક, શુદ્ધ બન્યાં છે. અને ગાંધીજીએ માનવતાની જેતી માટે ખેડેલું ખેતર તેના મોલથી સભર બની કોળી ઊઠે એવી શુભેચ્છા.

## ‘જ્યન્ત પાઠકનાં શ્રેષ્ઠ સોનેટો’ : વિદ્યાર્થીલક્ષી સંપાદન | દક્ષા વ્યાસ

[જ્યન્ત પાઠકનાં શ્રેષ્ઠ સોનેટો : સંપાદક દેવન્દ્ર દવે, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૨, પૃ. ૧૪૦, કિ. રૂ. ૫૦/-]

ગુજરાત સાહિત્ય અકાદમીની પુસ્તક-પ્રકાશનશૈળીના પચાસમા પુસ્તક રૂપે ‘જ્યન્ત પાઠકનાં શ્રેષ્ઠ સોનેટો’નું સંપાદન પ્રસિદ્ધ થયું એ એક આવકાર્ય ઘટના છે. જ્યન્ત પાઠક આપણા પાંચમા દાયકાના પ્રમુખ સૌંદર્યલક્ષી કવિઓમાંના એક છે એ તો ખરું જ; પરંતુ તે સાથે આધુનિકોના અછાંદસના કાચા પ્રોગો સામે આગવા અધ્યાંદસ દ્વારા તેમજો અભિવ્યક્તિમાં આધુનિકતાનું વલણ પણ દાખલ્યું છે. છ દાયકાના પ્રલંબ પટ પર પથરાયેલી એમની કાવ્યસાધનામાં તેજસ્વી કવિપ્રતિભાવાળા સમૃદ્ધ કવિની આગવી છાવિ ઊપરે છે. કાવિદાસ, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ, ઠાકોર – નહાનાલાલ, ઉમાશંકર – સુંદરમુ, રાજેન્દ્ર-નિરંજન વગેરેના સંસ્કાર છતાં પોતાના અવાજમાં ઊઠવા કરતા કવિ તરીકેનું દર્શન એમના પ્રથમ સંગ્રહ ‘મર્મર’થી જ થાય છે. અહીં તેઓ “ભાષા અને લયને રમાડીને નવું સૌંદર્ય દાખવવા શક્તિમાન કવિ” તરીકેની ઓળખ પામે છે. ત્રીજા સંગ્રહ ‘સર્ગ’થી એમનો આગવો અવાજ પ્રબળપણે ઊઘડી આવે છે અને તે ઉત્તરોત્તર વધુ દઢ થતો રહે છે. ગુજરાતી કવિતાને અનુભૂતિની સર્ચાઈથી રણકતા અતીતરાગનું કલામય મબલખ પ્રદાન કરનાર તેઓ અનોખા કવિ રહ્યા છે. એમની કવિતામાં શબ્દેશાબ્દના સૌંદર્યમૂલ્ય અને વંજકના અંગેની એમની સજગતા, ભાવ અને અભિવ્યક્તિની નજાકત અને સ્પર્શક્ષમતા આંખે ઊડીને વળ્ગે એવી છે. એ બધું તેઓ વિશદ્ધતા અને પ્રસાદ જાળવીને કરી શક્યા છે. આવા કવિનાં ઉત્તમ સોનેટોનું સંપાદન થાય તેમાં ઔચિત્ય છે જ.

આ સંપાદનમાં પહેલી નજરે થોડા આંચકા અનુભવ્યા તે વ્યક્ત કર્યા વિના રહી શકાતું નથી. ઉપરણામાં રંગોની પસંદગી-મેળવણી – સમગ્ર ઉદાવ મનને હરી લેતો નથી. પ્રસ્તાવના વિવરણમૂલક અને વિદ્યાર્થીલક્ષી હોઈ કવિનાં સોનેટોમાં રહેલી ચુસ્તતા, છંદશક્તિ, કટ્યનાશીલતા, અભિવ્યક્તિનો કસબ વગેરે પરતે કેન્દ્રિત થઈ શકાયું નથી. અનુકૂમણિકામાંથી પસાર થતાં ‘અક્ષર પગલે’નો ઉલ્લેખ ગાયબ ! તજ્જણના ધ્યાનમાં પણ તે ન આવ્યું ? ‘અક્ષરપગલે’ સંગ્રહ કદાચ સંપાદક લગી પહોંચ્યો જ નથી અથવા એમના ધ્યાન બધાર ગયો છે એમ સમજાય છે. કેમ કે એનો સમ ખાવા જેટલો પણ ક્યાંય ઉલ્લેખ નથી. જે-તે સંગ્રહનાં સોનેટ શરૂ થાય ત્યારે મથાળે સંગ્રહનું શીર્ષક શરૂમાં મુકાયું છે, જેમકે ‘મર્મર’, ‘વિસ્મય’, ‘સર્ગ’, ‘અંતરીક્ષ.’ પણ પછી ‘અનુનય’ શીર્ષક નથી. એ પછી ‘મૃગયા’ અને છેલ્દે ‘જાગરણ’ શીર્ષક મળે છે. વચ્ચેનાં ‘શૂળી ઉપર સેજ’, ‘બે અક્ષર આનંદના’, ‘નવાં કાબ્યો’ (એમાં ‘ભાષોમાં જીવું છું’નો ઉલ્લેખ નથી !) અને ‘દુતવિલંબિત’ શીર્ષકો નથી. તો ‘અક્ષરપગલે’ તો ક્યાંથી જ હોય ! જોકે જ્યાં

શીર્ષક નથી ત્યાં અતંત્ર રીતે કૃતિની નીચે પુસ્તક કે સામયિકનું નામ લખાયું છે. કામગીરી કંઈ વધુ પડતી ઉતાવળે જ થઈ હોશે? અલબટ 'અક્ષરપગલે' (૨૦૦૪)માં ગ્રંથસ્થ કાવ્યો અહીં છે જ, પરંતુ તે જેને સામયિકમાં પ્રસિદ્ધ થયાં હોય તેમાંથી લેવાયાં છે. કૃતિ ઉઠ્યે ૮૮ 'અક્ષરપગલે'માં ગ્રંથસ્થ છે, પણ અનુકૂળજીકામાં તે 'દૃત વિલંબિત'ના મથાળા હેઠળ મુકાયાં છે. (૭૬ મું 'વસંતે' સોનેટ 'અક્ષરપગલે'માં પ્રથમ પંક્તિને આધારે 'વૃક્ષે ફૂટી અરુણ કુપળ...' શીર્ષક હેઠળ છાપાયું છે. 'વિદાય વેળાએ મારી કવિતાના વાચકો (જો હોય તો)ને' – એ સોનેટ 'અક્ષરપગલે' અને 'જાગરણ' બંનેમાં છે.)

મોટા ભાગની કૃતિઓની નીચે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી શબ્દાર્થ અપાયા છે, ક્યાંક નોંધ પણ છે. એમાં મુદ્રણકળાનો લાભ લઈ શકાયો હોત અને ધાપકામને ઉઠાવ આપી શકાયો હોત. શબ્દવિરાણમાં એકસૂત્રતાનો અભાવ વરતાય છે. ક્યાંક લિંગ હોય, ક્યાંક વચન, ક્યાંક વિભક્તિ, ક્યાંક સંસ્કૃત હોવાનો નિર્દેશ. એક જ શબ્દનો અર્થ એકથી વધુ પાનાં પર મળી આવે છે, જેમ કે હેઠા (૬૧, ૬૨), ભાષ્ટ (૬૫, ૭૩), નવાજી (૬૬, ૭૩). સંપાદક પલાશ, કાનન જેવા શબ્દના અર્થ આપે છે, 'હર'નું વિશેષ અર્થઘટન આપે છે; પણ સ્વન, આત્મત જેવા શબ્દના અર્થ આપવા એમને જરૂરી જણાયા નથી. સમ્ર – ઊર્ધ્વની જેમ વિધોત (એમાંચ ધાપભૂત તો છે જ. વિધોત છાપાયું છે.) શબ્દની સમજ આપતા નથી. સમુદ્રરણ અને સમુદ્રરાર્થ બંનેના અર્થ આપે છે. આ સંપાદન એક એવો પણ પ્રશ્ન જગાડે છે કે સંપાદન યાંત્રિક રીતે કરવું જોઈએ કે એમાં સંપાદકે પોતાની સામાન્ય સમજનો ઉપયોગ કરવો જોઈએ? જેમ કે 'શ્રીઝ-મદ્ધાળન' (પૃ. ૩) સોનેટમાં બીજી પંક્તિમાં 'પ્રલંબ' શબ્દમાં મુદ્રારાક્ષસ છે એમ સ્પષ્ટ સમજાઈ જાય છે, છતાં તેનું 'પ્રલંબ' કર્યું નથી. ઊલંટું તેને તેમ જ રહેવા દઈ પાદ્ધીપમાં આમ સમજાયું છે : 'પ્રલંબ = સાચી જોડણી પ્રલંબ = વિ. લાંબું !' પૃ. ૨૧ ઉપર પાદ્ધીપમાં 'ગરમીની મોસમ (જેઠ અને અષાઢ)' એવી માહિતી છે જ. દરેક સોનેટને મથાળે તેનો પ્રકાર બતાવાયો છે. 'અંજતા'માં નથી. કવિના સંગ્રહ 'સંકેત'માં એકેય સોનેટ નથી તેનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં થઈ શકાયો હોત. ખરેખર તો પ્રસ્તાવના કવિસમગ્રનો નહીં, માત્ર સંગ્રહસ્થ સોનેટોનો જ આણો-પાતળો પરિચય આપે છે. તેથી 'ભીનું સમયવન' જેવા અપ્રતિમ સોનેટના નકશીકામ પર પ્રકાશ પડાયો નથી. 'આવ્યાં છો તો-'માં પ્રિયા તે કવિતા એમ પણ સૂચિત છે તે દર્શાવાયું નથી. એને કવિતાવિષયક નહીં, પણ પ્રેમવિષયક કવિતા જ ગણાવાઈ છે.

અહીં પસંદ થયેલાં સોનેટોમાં વિષયવૈવિધ્યનો ખ્યાલ રખાયો છે. એ રીતે કવિના ભાવવિશ્વની વ્યાપકતાનો પરિચય થાય છે. કવિની કવિતાની આધારશિલા છે પ્રકૃતિ. તો કેન્દ્ર છે પ્રેમ. આ પ્રેમ પ્રેરણિથી માંડીને મનુષ્ય, પૃથ્વી અને સમસ્ત સૂચિ સુધી વિસ્તરેલો છે, પણ પ્રકૃતિને મુકાબલે પ્રણયકવિતા ઓછી પસંદ કરાઈ છે એવી છાપ

ઉઠે છે. અલબત્ત પ્રત્યેક સંપાદકની પોતાની સ્વતંત્ર દર્શિ – પસંદગી હોવાની. તથાપિ વતનવનના એકાંતોમાં થતી શૈશવની અનુભૂતિને આલેખતું ‘શૈશવદર્શન’ કે કલ્યના અને કલ્યનની ઉડાનથી દીપ્ત અંધારું (વિસ્મય); પ્રણયવૈજ્ઞયની અનુભૂતિને તારસપ્તક પર આલેખતું સોનેટયુગમ મરણાંગડીએ’ (સર્જ) (‘સર્જનાં ૧૪માંથી ૪ પસંદ થયાં છે, થોડાં વધુ થાત !); અશારોહીનું પ્રભાવક ચિત્ર આપતું અશારોહી અને અપહરણ (ફુતવિલંગિત); ચૌદે ભુવનને રમણે ચઢાવતું ‘ફેરફૂદડી’ કે આગવાં વર્ણ-વિન્યાસથી મનરથના રૂપક દ્વારા વાર્ધક્યાનો અનેરો સાક્ષાત્કાર કરાવતું ‘વાર્ધક્યે મનોરથ’ (જાગરણ) જેવી કૃતિઓ મુકાઈ હોત ! – એવું પ્રલોભન થાય. ઘણી કૃતિઓ પરસ્પર સ્પર્ધા કરીને સંપાદકને મૂઝવાણમાં મૂકી દેતી હોય છે તેથી એમ તો બનવાનું જ.

‘કાલ્યપદાર્થની રઢ અને લગન’વાળા કવિ રચનાના સૌઝવનું; સંવેદન એક કલાપુદ્ગલ રૂપે શબ્દરૂપ પામે તેનું સતત ધ્યાન રાખે છે ને તેથી એમની પાસે અનેક સંવેદાઉતાર રચનાઓ મળે છે તેની પ્રતીતિ આ સોનેટો પણ કરાવે છે.

## ડાયસ્પોરિક ડિવેમા અથવા દરિયા-પારની દ્વિધા | પ્રીતિ સેનગુપ્તા

વિચાર ઘણા વખતથી આવ્યા કરે, પણ કઈ રીતે શરૂ કરવું તે સમજાય નહીં. વાત છે તો ગુજરાતી લેખન વિશેની, પણ એનો સંદર્ભ જરા જટિલ છે. શું મને જ લાગે છે એ જટિલ ?

ઓકે, તો વાત છે અત્યારે જેને “ડાયસ્પોરા સાહિત્ય” કહીને આગળ કરવામાં આવે છે તેની. શું આ શબ્દદ્વય વિશે બાકીનાં બધાં વિષદ છે ? બાકીનાં એટલે કે મારા સ્કિવાયનાં બધાં. થોડા મહિના પહેલાં મારી એક વાર્તાના વાંચન પછી મેં આ પ્રશ્ન પરિષદના શ્રોતાઓને પૂછેલો કે ડાયસ્પોરા કહો છો ત્યારે શું અપેક્ષિત ગણો છો ? ત્યારે જવાબમાં મને ડાયસ્પોરા શબ્દનો મૂળ અર્થ કહેવામાં આવેલો. પણ એ અર્થ તો હું જાણું છું – વર્ષોથી જાણું છું. મારે તો એ જાણવું છે કે જ્યારે આ શબ્દ ગુજરાતીમાં અને ગુજરાતી લેખનના સંદર્ભમાં વપરાતો થઈ ચૂક્યો છે ત્યારે એનો અર્થ-વિસ્તાર શું છે ? વળી, જ્યારે ‘ડાયસ્પોરિક’ (આ શબ્દ અંગ્રેજ શબ્દકોશમાં હજ નથી આવ્યો લાગતો, પણ હું વાપરવા માંડી છું) સાહિત્યનો ઉલ્લેખ થાય છે ત્યારે એની શું વ્યાખ્યા અભિપ્રેત હોય છે ?

એની વ્યાખ્યા બંધાઈ છે ખરી ? એમ હોય તો દરિયા-પાર રહેનારી-લખનારી મને જાગ હોવી ના જોઈએ કે મારી પાસેથી કશી અપેક્ષા છે ખરી ? જો હોય તો એ શી છે તેની મને ખબર ના હોવી જોઈએ ? જો ડાયસ્પોરા સાહિત્ય એટલે દરિયા-પારથી લખાતું સાહિત્ય – આવો સીધો અર્થ થતો હોત તો મને જાણ-સમજણ મળી ગયાં હોત (મારા પ્રવાસ-લેખનના સંદર્ભમાં પણ), પરંતુ આવું સીધું ને સહેલું બન્યું નથી લાગતું.

ન તેથી હું આજ્જાપૂર્વક પૂછ્યા કરું છું, આ શબ્દદ્વયની વ્યાખ્યા ને અપેક્ષા શું છે ? કોઈ કહે, દેશ – એટલે કે ઈન્ડિયાવિષયક કથાનક ના જ હોવું જોઈએ. કોઈ કહે, પર-દેશના જીવન વિશે જ લખાવું જોઈએ. કોઈ વળી કહે, પાત્રો દેશી તથા પર-દેશી, એમ બને બાજુનાં હોવાં જોઈએ. અને વળી, વિષય તથા નિરૂપણ-શૈલીની બાબતે પણ મને અમૃક મુંજવણ છે.

જે સ્વગત રહેલું છે તેવું થોડુંક અહીં પ્રગટ કરવા માગું છું. ડાયસ્પોરા શબ્દ હું અહીં નહીં વાપરું. દરિયા-પાર શબ્દ ચાલશેને ? વળી, અમે ને તમે, કે અહીંનાં ને ત્યાંનાં – જેવા શબ્દો પણ હું આ લેખન માટે વર્જય ગણું છું. તેથી દરિયા-પાર, પર-દેશ અને દેશ જેવા શબ્દ હું પ્રયોગશ.

એક, દરિયા-પારનાં લખનારાંએ ઈન્ડિયાવિષયક કથાનક ના જ લખવાં જોઈએ,

એમ જો મનાતું હોય તો મારે આમ કહી સમજવું પડે, કે ઘર-જુરાપા વિશે તો દરિયા-પાર, કે દેશ-પ્રાંત-શહેર-બહાર, કે ઘરથી દૂર રહેનારાં જ લખી શકે. વિયોગ અને વિચ્છેદનો આ ભાવ મનમાંથી વિમુખ કરવો હુઝર છે. અન્ય સ્થાને વસવા ને જીવવા છતાં જે સ્થાન છોડવું છે તે જીવમાંથી જતું નથી.

આ સાથે જ, દરિયા-પાર અત્યારે એવા લોકોની સંખ્યા વધતી જાય છે કે જે ઇન્દ્રિયાથી વિમુખ થઈ ગયેલા હોય, ઇન્ડિયા જવા જ ના માગતા હોય, ને એમને ઇન્ડિયન કાર્યકર્મા કે મંદિરોમાં પણ રસ જ ન હોય. આ લોકો ગુજરાતી વાંચતા પણ નથી, અને એ લોકો ગુજરાતી લખનારા તો નથી જ. જ્યારે ભાષા સાથેનો (ગુજરાતી)નો સંપર્ક છૂટી જાય છે ત્યારે તે સ્થાન (દેશ) સાથેનું વળગણ પણ નથી રહેતું.

બીજું, ગુજરાતી ભાષા સાથે દરિયા-પારથી જે બધાં હજી પરોવાયેલાં છે તે બધાં ગુજરાતી સંદર્ભ બિલકુલ બંખેરી નથી જ શકતાં. ઉપરાંત, વાસ્તવિકતા પણ જાણવી પડે, ને તે એ કે દરિયા-પાર વસવાનારાં પોતપોતાનાં કૌટુંબિક અને પ્રાંતીય જૂથોમાં જ વધારે રત હોય છે. વસવાટના દેશ (પર-દેશ)ના જીવન તથા અન્ય પ્રજાજનો સાથે એમનું હળવું-મળવું, આદાન-પ્રદાન ક્યાં તો નહીંવત્ત હોય છે, ક્યાં તો હોતું જ નથી. આથી, સ્વાચ્છ રીતે જ, તદ્વન બિન-ઇન્ડિયન અને પૂર્ણ-પરદેશી રહેણીકરણી અને મનોવિચાર વિશે પ્રમાણભૂત રીતે લખવું દરેક લખનાર માટે શક્ય ના પણ હોય.

દરિયા-પાર જન્મેલી કે ઊંઘરેલી પેઢી લગભગ સંપૂર્ણ રીતે વસવાટના દેશની બની જતી હોય છે. એ સમજવું, અને માન્ય કરવું અધિક નથી, કારણ કે એમને માટે આ જ ઘર છે, અહીં જ એમણે સ્થાયી થવાનું છે. એમણે બિન્ન નહીં, સમાન થવા મથવું પડતું હોય છે. આ યુવા પેઢીનાં વલાણ, વર્તન અને જીવન વિશે, ગુજરાતીમાં લખનારાં (મા-ભાપો કે દાદા-દાદીઓ) લખી શકે. તો એ દરિયા-પારના જીવનનું પ્રતિબિંબ કહેવાય. અલબત્ત, ઇન્ડિયન કુટુંબો સાથે જોડાયેલું.

ગુજરાતી જ નહીં, ઇન્ડિયન જ નહીં, અન્ય કોઈ પણ સ્થાનેથી આવીને દરિયા-પાર સ્થાયી થયેલાં સર્જકો લખે છે ત્યારે પોતાના દેશનાં જીવન અને એનાં સ્મરણોનો પૂરેપૂરો આધાર લેતાં હોય છે. હું અમેરિકામાં જાણીતાં બનેલાં, ફિક્શનનાં અને દસ્તાવેજી કેટલાંયે પુસ્તકો જોઉં છું તો એ બધાનાં વિષય-વસ્તુ હોય છે પોતાની માતૃભૂમિ, પોતાના બાળપણના અનુભવો, અથવા તે તે સ્થાનની આજની સ્થિતિ. લખનારાં ભલે ને અમેરિકી, યુરોપી, આફ્રિકી કે અન્ય-અંગીય હોય.

જાળીતાં બનેલાં ઇન્ડિયનોનાં કેટલાંક નામો જોઈએ – પંકજ મિશ્રા, ચિત્રા બોનરજી દિવાકરુની, ભારતી મુકરજી, અમિતાભ ઘોષ, કિરણ દેસાઈ, વિકમ ભટ વગેરે, તો શું જોવા મળે છે? ઇન્ડિયાનું જ પ્રતિબિંબ. તે પણ જુરાપાના ભાવથી મિશ્રિત. દરિયા-પારનાં આ તથા અન્ય લખનારાંનું લેખન એમનો દાખિકોણ નિરૂપે છે જે દેશમાંનાં

લખાણમાં હોય તેનાથી જુદ્ધો પડતો જોવા મળે છે. એમનો છે તે દરિયા-પારનો દસ્તિકોણ છે, એ “ડાયસ્પોરિક ડિસ્કોર્સ” છે.

આમાં અત્યંત સૂચક એવી બાબત છે એ છે કે આ ઈન્ડિયન સર્જકો અંગેજ ભાષામાં લાગે છે, નહીં કે પોતપોતાની માતૃભાષામાં. આ બધાં દેશ ને વિદેશોમાં જાણીતાં બન્યાં છે અંગેજ ભાષાના સેવનને કારણે. દરિયા-પાર રહીને માતૃભાષામાં લખવાની પ્રવૃત્તિ રણમાં આંબા ઉછેરવા જેવી ગણાય, અથવા હતક લીધેલા બાળકની જતનપૂર્વકની માવજત કરવા જેવી ગણાય.

ત્રીજું, પાત્રો ઈન્ડિયન અને પર-દેશી એમ બંને હોવાં જ જોઈએ, આ બાબતે દરિયા-પારના ગુજરાતી લેખન પર જ ધ્યાન મૂકીએ, તો એક ઉપરછલું સામાન્યીકરણ કરી શકાય કે પરદેશી પાત્રોનાં જીવન-રીતિ અને મનોવિચાર માટે ન્યાય જાણકારી, તેમજ ઊંડો રસ, તથા એમની સાથે ઘનિષ્ઠતા બહુ ઓછાંને હશે. આથી પાત્રાલેખન રસપ્રદ અને પ્રમાણભૂત બને કે નહીં, તે વિચારનું પડે.

તદ્દુપરાંત, સામાન્યતયા, સંપર્ક સાધારણ પરદેશી વ્યક્તિઓ સાથે રહેવાનો. પર-દેશના સમાજના વિખ્યાત, ધનિક અને આગળ પડતા લોકો સાથે ઓળખાણ કેટલાંને હોવાની ? હા, કેટલાંકને હોય પણ ખરી, પણ એમાંનાં પાછાં ગુજરાતીમાં લખનારાં પણ હોવાનાં કે ? સાધારણ જાણેલું કે વાંચેલું હોય તે પરથી કોઈ પાત્ર બનાવી શકાય તો ખરું, પણ તે કદાચ સ્કેચ રૂપે. આખી નવલકથા આ રીતે લખી શકાય ખરી ?

નવલકથાનો ઉત્થેખ હમજુંં ભગતભાઈ શેઠ પાસેથી સાંભળ્યો. એ અહીં અમેરિકામાં ફરવા-મળવા આવ્યા હતા, ત્યારે એક વાતચીત દરમિયાન એમણે કહ્યું, “અહીંથી (એટલે કે દરિયા-પારથી) હજુ આપણને સારી નવલકથા નથી મળી.” બરાબર એક પ્રકાશકને થાય તેવું નિરીક્ષણ, ખરું કે નહીં ? આ બાબત માટે મારી જે કંઈક સમજજણ છે તે આમ છે. અમેરિકામાં અત્યારે વસ્તાં ગુજરાતીઓમાંનાં મોટા ભાગનાંને અહીં આવ્યે ત્રીસ-પાંત્રીસ વર્ષ થયાં. એમાંનાં પહેલાં વીસ, ને કદાચ પચીસ પણ, વર્ષો સ્થાયી થવા માટેની મહેનત-મથામણમાં, તેમજ સંતાનોના ઉછેર પાછળ ક્યાંયે વીતી જતાં હોય છે.

શરૂઆતનાં એ વર્ષો દરમ્યાન તો કોઈને જાણે ઉંચું જોવાનો ટાઈમ મળતો નથી. અમેરિકામાંના ગુજરાતી લેખનની તવારીખ તરફ કોઈ નજર કરે તો જણાશે કે છેલ્લાં લગભગ દસ-પંદર વર્ષથી અહીં આ લેખન-કામ થઈ રહ્યું છે. લખનારાં ધીરે ધીરે વધારે અને જુદા જુદા પ્રકારોમાં લખવાના પ્રયત્ન કરતાં થયેલાં જણાય છે. ઇતાં, નવલકથા લખનારાં કેટલાં હોય ? ક્યાંયે પણ ? દરિયા-પારથી નવલકથા લખી હોય તેવાં બે-ત્રાણ જણ જરૂર છે. નાનપણથી આજ સુધીમાં અસંખ્ય વાંચી હોય તેવાં અનેક હોય, પણ તેથી કરીને એક સારી ફૂતિ લખતાં બધાંને આવડી જવાની નથી.

ચોંબું, દરિયા-પારના લેખનમાં જો પર-દેશને લગતા વિષયોની અપેક્ષા હોય તો મારા મનમાં પ્રશ્ન છે કે એવા વિષયો ગુજરાતના વાચકોને ગમશે ? એમાં રસ પડશે ? એમાં અમુક સંદર્ભ આવવાના, કે જીવાઓ તથા વ્યક્તિઓનાં નામ આવવાનાં, તે વાચકોને પકડાશે ?, ગમશે, રસદ્વોત્ક લાગશે ? વળી, વાચકની ચેતનામાં પર-દેશને અંગે ખોટી છાપ ઊભી ના થવી જોઈએ. સાહિત્યની એક કૃતિમાં કોઈ પણ સ્થાન, કે પર-દેશની સમગ્રતાનું દર્શન મેળવી ના શકાય. પર-દેશીઓને અને ભારતીયોને પરસ્પરની વાતસ્વિકતા આશ્ર્ય અને આધાત પમાડવાની, તેથી પરસ્પરનાં જીવનનાં સભીકરણોની જાણકારી વ્યાપક રૂપે હોય તે આવશ્યક છે.

પાંચમું, નિરૂપણ ઉપરાંત શૈલી અંગે પણ હું મૂંઝાઉં છું. જો પર-દેશી પાત્રોનું નિરૂપણ કરીએ તો એમના સંવાદો કઈ ભાષામાં મૂકવાના ? ગુજરાતીમાં ચાલે ? તો એ પાત્ર ખાતરીલાયક બનશે ? કે સંવાદો અંગ્રેજમાં હોવા જોઈએ ? તો એ અંગ્રેજ લિપિમાં લખવાના, કે ગુજરાતી લિપિમાં ? કઈ રીતે એ વાંચનમાં દખલ રૂપ નહીં લાગે ? કે કથાનકમાં રસભંગ નહીં કરાવે ? આ પ્રશ્નોના જવાબ પણ મને અભ્યાસીઓ પાસેથી મળ્યા નથી.

ગુજરાતી લખાણોમાં જ્યારે અંગ્રેજ સંવાદો ગુજરાતીમાં વાંચવા પડે છે ત્યારે અને અંગ્રેજ લિપિમાં મુકાયેલા હોય છે ત્યારે પણ, હંમેશાં ખટકે છે. એક કારણ એ કે અંગ્રેજ લગભગ હંમેશાં ખોટું હોય છે – સ્પેલિંગ, વ્યાકરણ તેમજ ઉચ્ચારોની રીતે અને હમણાંથી ઉચ્ચારોની બાબતે એક એવી બેદરકારી સાંભળું છું કે કાન ખરી પડવા દ્યાયે છે. ગુજરાતીમાં તો ભલભલા લોકો – સર્જકો અને સ્કોલરો પણ – “શા”નો “સ” બોલતા થઈ જ ગયા છે. ને હવે એ જ લોકો અંગ્રેજ ભાષાના “શ” ધ્વનિને પણ “સ” ધ્વનિ બનાવી દેવા માંડ્યા છે. દા.ત. શનિવાર તો સનિવાર બની ગયેલો હતો જ, પણ હવે ‘શાવર’ (વરસાદ કે સ્નાન) પણ ‘સાવર’ (ખાટું) બનેલો છે.

પોતાની ભાસાનું જે થવાનું હસે તે થસે, પણ બીજાંની ભાસાને પણ બગાડવાની ? આ તો ભવિસ્ય માટે બહુ નિરાસાજનક બનસે, અથવા સ્યોરલિ વેરિ સેમકુલ, એન્ડ સોકિંગ જેવું ગણાસે... વગેરે.

ગુજરાતીમાં લખીએ ત્યારે પાત્રોને અનુરૂપ ભાષાના સંવાદો આપણે મૂકી શકીએ છીએ. અન્ય-દેશીય પાત્રો નિરૂપાયાં હોય ત્યારે એમને જુદી જુદી બોલી કે વાક્ષયનાં વાક્યો કેવી રીતે મૂકવાં ? મારાં અમેરિકન ભિત્રો પાસેથી મેં સાંભળ્યું અને જાણ્યું છે તે પ્રમાણે અમેરિકી (તેમજ અન્ય) અંગ્રેજ ભાષામાં પણ તળપદી કહી શકાય તેવી બોલી હોય છે, અને રોજિંદી વાતચીતમાંથી વપરાશમાં આવેલા વિશિષ્ટ શબ્દ-પ્રયોગો પણ હોય છે. અમેરિકામાં ફરતાં રાજ્યે રાજ્યે અંગ્રેજ જુદું બનતું જાણાશે, અને સંભળાશે.

પાત્રાલેખનની આવશ્યકતા મુજબ જો આવી બોલી કે શબ્દો પ્રયોજવામાં આવે

તો એમની સમજૂતી પણ કોઈક રીતે આપવી પડે, નહીં તો ભાષાની એ છટાઓ (ગુજરાતી) વાચકને સમજારે નહીં, બલ્કે કંયાળો આપશે. આવાં શબ્દો ને વાક્યો અંગેજ લિપિમાં જ લખવાં પડે, નહીં તો એ યથાર્થ કરી રીતે બને? તો પછી, ફરી એ પ્રશ્ન કે ભાષાની આ બેળસેળ રસપ્રદ બનશે ને?

મનની આવી મૂળવણો ઉપરાંત મારું માનવું એમ છે કે દરિયા-પારથી થતા લેખનને માટે આટવું ઝટપટ એક લેખલ ના લાગી ગયું હોત તો સારું થાત. દરિયા-પારનાં પર, કદાચ, ખાસ ઠિપ્પોશન પાડવા માટેનું એક પ્રેશર પડવું છે, પણ આવા કેટલાક પ્રશ્નોના ઉત્તર-ઉકેલ નથી મળ્યા. કે પછી આવી બહુ કશી ચિંતા કર્યા વગર વહેતાં રહેવાનું પાતળા પ્રવાહમાં?

### લેખકની ખુમારી | કુલીનંદ પો. યાણીક

દુંગલેન્ડના ૧૮મી સદીના પ્રખર વિદ્વાન ડૉ. જહોન્સન (૧૭૦૮-૧૭૮૪) અંગ્રેજીના મૂર્ધન્ય સાહિત્યકાર અને વિખ્યાત કોશકાર હતા. નાની વયથી એક જ આંખે ભાગતા ડૉ. જહોન્સન હષ્પુષ હતા. અને નબળું સ્વાસ્થ્ય પણ અજેય આત્મબળ ધરાવતા. એમના નિબંધો, સાહિત્યિક વિવેચનો વગેરે લખાશો ઉપરાંત કોઝી હાઉસમાં મિત્રમંડળમાં તેમના વાર્તાલાપો અને સંવાદોથી તે વિખ્યાત છે. એ અગાધ જ્ઞાની, નિર્ભય સ્પષ્ટવક્તા હતા અને રમૂજ અને હાજરજવાબી ('રિપાર્ટી')ના સ્વામી હતા. એમનું સાક્ષરજીવન એમના વિખ્યાત ચરિત્રકાર જેમ્સ બોસ્વેલના પુસ્તક ઉપરથી તાદ્દશ થાય છે.

ડૉ. જહોન્સનનો શબ્દકોશ એના વ્યાપક અને એની લાક્ષણિક શૈલી માટે આજેય વખણાય છે. ૧૮૨૮માં ઓક્સફર્ડ દ્વારા ડિક્ષનરી પ્રગટ થઈ ત્યાં સુધી (લગભગ ૨૦૦ વર્ષ સુધી) તે આધારભૂત ગણાતો હતો. એમણે તે એકદે હાથે તૈયાર કર્યો હતો. તે સમયના સાહિત્યકાર અને સાહિત્યપુરસ્કર્તા તથા સમાજમાં વગદાર ઉમરાવ લોડ ચેસ્ટરફીલ્ડ શરૂઆતમાં ડૉ. જહોન્સનને કેંક સૌજન્ય બતાવી પાછળથી તેમની અવગણના કરી અને પછી પાછો તેમનો શબ્દકોશ પ્રગટ થયો ત્યારે તેને જાહેરમાં વખાણ્યો, ત્યારે ડૉ. જહોન્સનને તેમના ઉપર લખેલા વિખ્યાત પત્રમાં તેમની ખુમારી અને તેમનું સ્પષ્ટવક્તૃત્વ પ્રગટ થાય છે.

ડૉ. જહોન્સનનું ગદ્ય અધરું હતું. મોટા મોટા શબ્દો અને લાંબાં લાંબાં વાક્યો. તેનું શબ્દશઃ ભાષાંતર તેમની જ શૈલીમાં કરીએ તો દુર્ભોધ બને. શક્ય તેટલી સરળ, બોલચાલની ગુજરાતીમાં ઉતારવું જોઈએ. અહીં એક પ્રયત્ન સાદર છે – એવી આશા સાથે કે ગરવી ગુરુજીના સારસ્વતો પણ પ્રસંગોપાત્ર આવું ખમીર બતાવે.

બીજું આશ્રમ્ય. લોડ ચેસ્ટરફીલ્ડને આ પત્ર એટલો ગમ્યો હતો કે તેમણે તેને

મબાવીને દીવાનખાનામાં રાખ્યો હતો. આપણા સખી દાતાઓ અને આગેવાનો માટે આ એક ઉદાહરણ છે.

સાધેભરમાં તેમની ત૦૪મી જન્મજયંતી આવે છે તે પ્રસંગે આ પ્રસ્તુત છે.

\*

માય લોર્ડી,

‘ધ વર્દ્ધના માલિકે મને હમણાં જણાયું છે કે મારા શબ્દકોશની જનતાને ભલામણ કરતા બે લેખો આપ નામદારના લખેલા હતા. આવો વિશ્વાસ ઉલ્લેખ એક મોટું સંન્માન ગણાય; પણ મહાન માણસો પાસેથી કૃપાદાન મેળવવા હું ટેવાયો નથી, તેથી તેને કેમ આવકારવું તે, અથવા તેને માટે કયા શબ્દોમાં આભાર માનવો તે હું બરાબર જાણતો નથી.

અગાઉ જ્યારે આપ નામદારની મેં પહેલી વાર મુલાકાત લીધી ત્યારે મળેલા જરા જેટલા પ્રોત્સાહનથી બીજા સામાન્ય માણસો માફક આપની મોહક શાલીનતાથી હું અત્યંત પ્રભાવિત થયો હતો. અને મારી જાતને વિશ્વિજેતા માન્યા વગર હું રહી શક્યો નહિ. અને મેં માન્યું કે સારી દુનિયા જેને માટે પ્રયત્ન કરે છે, તેવી મહેર મારા ઉપર પણ થશે. પણ મને સમજાયું કે મારી હજરી એટલી ઓછી આવકાર્ય હતી, કે ન મારું સ્વમાન કે ન તો મારી નમતા મારી ઉપસ્થિતિ ચાલુ રાખવા દે. જ્યારે એક વાર આપ નામદારને જાહેરમાં સંબોધન કર્યું, ત્યારે એક નિવૃત્ત અને નિરાંબરી સંશોધક ધરાવી શકે તેવી બધી જ ખુશ કરવાની કણા મેં વાપરી નાખી હતી. મેં મારાથી થઈ શકે તે બધું જ કર્યું હતું અને પોતાનું બધું જ – પછી તે હકીકતમાં ગમે તેટલું ઓછું હોય તોપણ – અવગાણના પામે ત્યારે કોઈ મનુષ્ય રાજુ થતો નથી.

નામદાર ! આપના પ્રતીક્ષાંંડમાં હું આપની વાટ જોયા કરતો, અથવા આપને દરવાજેથી મને પાછો વાળવામાં આવતો, તેને સાત વર્ષ વીતી ગયાં છે. આ સમય દરમિયાન મારું કામ હું મુશ્કેલીઓ વચ્ચેથી ધકેલ્યા કરતો હતો. તે મુશ્કેલીઓની ફરિયાદ કરવી નિરથી છે. હવે આ કામ છેવટે પ્રગટ કરવાને આરે લાવીને મૂક્યું છે – તેમાં કશી પણ સહાય વગર, પ્રોત્સાહનના એક પણ શબ્દ વગર, અથવા એક પણ માણણું સ્વિત વગર. આવી વર્તણૂકનો મેં અંહેશો રાખ્યો ન હતો, કારણ અગાઉ મને કદી કોઈ પેટ્રન સાંપર્ક્યો ન હતો.

(અહીં એક પુરાણો લેટિન સંદર્ભ ટંક્યો છે.)

નામદાર ! પેટ્રન કોને કહેવાય ? પાણીમાં પડેલો કોઈ માણસ જીવ બચાવવા તરફાદિયાં મારતો હોય ત્યારે તેના તરફ લાપરવાહીથી જોયા કરે, અને એ કિનારે પહોંચે ત્યારે તેના પર સહાયનો ભાર લાદે, તેને જ પેટ્રન કહેવાય, નહિ ? આપે મારા પ્રયત્નની નોંધ લેવા કૃપા કરી, તે વહેલી આવી હોત, તો હુંઝાળી લાગત, પણ હવે તે એટલી

મોડી પડી છે કે હવે હું ઉદાસીન છું અને તેથી તેનો આનંદ માણી શકતો નથી. હવે એકલવાયો છું અને બીજાને કહી શકતો નથી અને જાણીતો થઈ ચૂક્યો છું અને મને એની જરૂર નથી.

મને જ્યારે કોઈ કાયદો થયો નથી, ત્યારે હું કોઈ આભાર પણ ન માનું અથવા વિધાતાએ પોતે એકલાપંતે પહોંચી વળવાની આપેલી શક્તિ માટે મને કોઈ પેટ્રનનો આધાર હતો એમ જનતા માને તે મને પંસદ ન હોય, તો તે મારા પણ હતાશાભરી તોછાઈ માની લેવાશે નહિ, એવી હું આશા રાખ્યું છું.

અત્યાર સુધી વિદ્યાના કોઈ પણ આશ્રયદાતા સિવાય મેં મારું કામ ચાલુ રાખ્યું છે, ત્યારે તે ડેંક ઊણપ સાથે પણ પૂરું કરી શકાય તો તેવી ઊણપથી હું નાસીપાસ નહિ થાઉં, કારણ કે હું અતિઆનંદ અને ગર્વથી જે આશાભર્યું સ્વભ જોતો હતો તેમાંથી ઘણા સમય પહેલાં જાગી ગયો છું, જેમાં હું એક ગર્વ અને આનંદથી ગરકાવ હતો.

નામદાર ! આપ નામદારનો અત્યંત વિનમ્ર, અત્યંત આશાંકિત સેવક,

સે. જહો.

## ભૂલસુધાર

‘પરબ’ (ઓગસ્ટ ’૧૩)માં શ્રી ધીરેન્દ્ર મહેતાના લેખ ‘ટૂકી વાર્તામાં વાતાવરણ : વીનેશ અંતાણીની વાર્તાઓ’ના અંતે નીચેના બે ફકરા ઉમેરીને વાંચવા વિનંતી. —

જોઈ શકાશે કે અહીં સ્થળ, પાત્રસંવેદન સાથે સંકળાઈને તેને અભિવ્યક્ત કરે છે પરંતુ એ ભાવકના અનુભવનું ઉપાદાન બનતું નથી. આમ એ વાર્તામાં ‘વાતાવરણ’ રચતું નથી. સ્થળ ઇન્દ્રિયગમ્ય હોય છે; વાતાવરણ ગમ્ય હોય છે, ઇન્દ્રિયગમ્ય નહિ.

ઘટનાની ચોટ, અંતમાં સધાતી ચમત્કૃતિ, હંદયમાં જગા કરી લેતું ચરિત્ર : ટૂકી વાર્તા કેટકેટલી રીતે યાદ રહી જતી હોય છે ! ... પણ વાતાવરણ, એ કદાચ શાસમાં ભળી જઈને ભીતર ઊતરી જતું અનુભૂત તત્ત્વ છે ! ભાવકને એક અનુભવમાં એ મૂકે છે. અને બદલાયેલી રૂચિના ભાવક માટે કશો બોધ કે સંદેશ કે એવું કરીક ગ્રહણ કરવાને બદલે આવા કોઈ અનુભવમાં મુકાવું વિશેષ રૂચિકર નીવડે છે, જેમાં કૃતિ વાંચી લીધા પછી પણ એની મોજૂદગી હોય.

## ભૂતસુધારનોંધ

ઓગસ્ટ ૨૦૧૩ના પરબ'ના આવરણ પર છપાયેલી ઇમેજ મૂળે સાટેમબર માસના અંક માટે હતી (એ શિલ્પકૃતિના કલાકાર સોમનાથ હોડ (૧૯૨૧-૨૦૦૬) છે.) આસ્વાદનોંધ સાથે એ ઇમેજનું વાચન કરતી વખતે ભાવકોને મુંઘવણ થઈ તે બદલ હું બંને કલાકારોની તેમજ આપ સહુ વાચકોની ક્ષમા યાચું હું. આ અંકે જ્યોતિ ભજું સંદર્ભે લખાયેલી નોંધ ટૂંકાવીને પીયૂષ ઠક્કરે મોકલી છે, એ પ્રકાશિત કરીએ છીએ. આવતા મહિને કલાકાર સોમનાથ હોડની અન્ય કૃતિ સંકળીને શ્રી પીયૂષ ઠક્કર વિગતે આસ્વાદ નોંધ આપશે.

- તંત્રી

## પરિષદના આગામી કાર્યક્રમો

### પાદ્ધક્કી

સંયોજક દીવાન ઠાકોર : તા. ૫-૬-૨૦૧૩ના રોજ સાંજે ૬ વાગે શ્રી ઉર્મિ પંડિતનું વાર્તાપદન.

તા. ૧૯-૬-૨૦૧૩ના રોજ સાંજે ૬ વાગે શ્રી મોહન પરમારનું વાર્તાપદન અને આસ્વાદ.

### એનીબહેન સરૈયા પ્રોત્સાહ નિધિ અંતર્ગત

સંયોજક પારુલ કંદર્પ ટેસાઈ, પ્રક્ષા પટેલ. તા. ૧૬-૬-૨૦૧૩ના રોજ સાંજે ૪.૦૦ કલાકે લેઝિકા ગોળિ કાર્યક્રમમાં બહેનોએ લખેલી કૃતિનું વાચન અને આસ્વાદ.

### વિશ્વકવિતપદ્ધ

તા. ૪, ૧૧, ૧૮, ૨૫-૬-૨૦૧૩ના રોજ બુધસભા સાંજે ૭.૦૦ કલાકે.



### સાહિત્યસિદ્ધાંત વાખ્યાનશ્રોણી-૨

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર અંતર્ગત તા. ૫-૮-૨૦૧૩ના રોજ ‘સાહિત્યસિદ્ધાંત વાખ્યાન શ્રોણી-૨’નું આયોજન કર્યું હતું. જેમાં યુ.એસ.એ.ના ફિલોડેલ્ફિયામાં પેન્સિલ્વેનિયામાં ગુજરાતી ભાષાના અધ્યાપક ડૉ. બાબુ સુથારે ‘દેરિદાના અનુસંચનાવાદ’ પરની પરિચર્યામાં સાહિત્ય અને ફિલોસોફી પર ચર્ચા કરી હતી. વક્તવ્યમાં તેમજો કદ્યું હતું કે, આપણી ભાષામાં અનુસંચનાવાદની પ્રથા નથી, આ પ્રકારની શિયરીને ધતિંગ જેવી માનવામાં આવે છે. તેમજો તત્ત્વજ્ઞાની દેરિદાની વાત કરતાં કદ્યું હતું કે ઈલ્લા, જર્મની, ફાન્સ જેવા દેશોમાં આ પ્રકારના કોમ્યુનિટી આઈડિયા પર કામ થઈ રહ્યું છે. કોમ્યુનિટી આઈડિયાનું ઉદાહરણ આપતાં તેમજો જગ્ઘાવ્યું હતું કે, ‘આપણા સાહિત્યમાં સુદામા ચચ્રિમાં આ વિષયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમાં મિત્રતા મિત્રતા નથી.. કૃષ્ણ એવું વિચારે છે કે, મારી પાસે જે છે એ બધું જ સુદામા પાસે હોવું જોઈએ, પરંતુ શું સુદામા આવું વિચારી શકે કે, મારી પાસે જે છે એ બધું જ કૃષ્ણ પાસે હોવું જોઈએ ?’ આ ઉપરાંત તેમજો યુરોપમાં દેરિદા પદીના ફિલોસોફીના માહોલની વાત કરી હતી.

ફિલોસોફીની આજની સ્થિતિ અંગે વાત કરતાં તેમજો કદ્યું હતું કે ‘છેલ્લી સહીમાં બે વિશ્વયુદ્ધો મળીને આપણી સાથે ઘણી ઘટનાઓ બની ગઈ છે. હાલ તો આ વિશ્વયુદ્ધોને પણ ભૂલાવી દે એવી સ્થિતિ માર્કેટની છે. આમ આપણાં માનસ પર કેપિયાલિઝ છવાઈ ગયું છે. ત્યારે સાહિત્ય પણ વાસ્તવિકતાની ડિમાન્ડ કરે છે.’ આ વક્તવ્યમાં બાબુ સુથારે માયામુખ, બાલદિલ, બર્નાડ સ્થિન્ડર, સાર્ટ અને હેડિંગર વગેરે ફિલોસોફીર્સ વિશે રસપ્રદ ચર્ચા કરી હતી. અજ્ય રાવલે વક્તાશ્રીનો વિગતે પરિચય કરાવ્યો હતો. પાતુલ કંદર્પ દેસાઈએ સંચાલન સાથે સરસ ભૂમિકા બાંધી આપી હતી. વાખ્યાનના અંતે ઉપરિથિત સાહિત્યરસિકોએ ફિલોસોફી વિશેના વિવિધ સવાલોનાં સમાધાન પણ મેળવ્યાં હતાં.

### ઇતુભાઈ ફુર્કુટિયા

ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વમુખ શ્રી ભોળાભાઈ પટેલના જનમાનિક નિમિત્તે

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભોળાભાઈના વિદ્યાર્થીઓ દ્વારા તા. ૭-૮-૨૦૧૩ના બુધવારે સાંજે ૫.૩૦ કલાકે રઘુવીર ચૌધરીની અધ્યક્ષતામાં શ્રી ભોળાભાઈ

પટેલના જન્મહિવસે ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં આ વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે ભોળાભાઈના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ભોળાભાઈ પટેલ – સર્જક અને સર્જન’ દર્શાવવામાં આવી હતી. જેમાં ભોળાભાઈ પટેલનો સાહિત્યિક પરિચય મળે છે. પ્રારંભે નીતિન વડગામાંથી ભૂમિકા બાંધી આપી હતી. જેમાં તેમણે કદ્યું હતું કે, ભોળાભાઈને ઉમાશંકર પ્રત્યે વિશેષ લગાવ હતો. શિરીષ પંચાલે વીરેન્દ્રનારાયણ સિંહ સંપાદિત ‘અક્ષર શઃ ઉમાશંકર’ વિશે વક્તવ્ય આપ્યું હતું. જેમાં ભોળાભાઈએ ઉમાશંકર જોશી વિશે લખેલા લેખોના સંપાદન વિશે વિગતે ચર્ચા કરી હતી. વીરેન્દ્રનારાયણ સિંહે સંપાદક તરીકે વક્તવ્ય આપતાં કદ્યું હતું કે ‘મારું એ દુર્ભાગ્ય છે, કે તેમના અવસાનના બે છિવસ પહેલાં હું બનારસ ગયેલો. તેમણે તેમના અંતિમ ત્રણ છિવસોમાં લખેલા પત્રોમાં તેમણે ટાગોર, કાલિદાસ અને ઉમાશંકર પરનાં પુસ્તકો પૂરાં કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં ઝડપી અને સૌથી સરળ કામ ઉમાશંકર પરનું હોવાથી અમે પ્રથમ આ પુસ્તકના સંપાદનનું કાર્ય હાથ ધર્યું. યજોશ દવેએ ભોળાભાઈ પટેલ સાથે કરેલી મુલાકાતના લેખોનું પુસ્તક ‘અંતરંગ બહિરંગ’ વિશે વક્તવ્ય આપતાં કદ્યું હતું કે, ભોળાભાઈ ફેરલ ગવર્નમેન્ટના સભ્યની જેમ સર્વમાન્ય હતા. તેમનું સાહિત્યનું ખેડાજ આજાનબાહુ જેવું હતું. જેમાં તેમનો જમણો હાથ સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યને અડતો હોય તો, ડાબો હાથ જર્મન કે અંગ્રેજ સાહિત્યને અડતો હોય અને વચ્ચમાં ગુજરાતી, બંગાળી, અસમી અને ઉર્ડિયા જેવી ભાષાઓ આવે છે. રઘુવીર ચૌધરીએ અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું હતું. બિંદુ ભાડે સરસ સંચાલન સાથે ગુરુ ભોળાભાઈ પટેલ સાથેનાં સંસ્મરણોને યાદ કર્યા હતાં. આ પ્રસંગે ‘અક્ષરશઃ ઉમાશંકર’ અને ‘અંતરંગ બહિરંગ’ પુસ્તકોનું લોકપર્ષણ કરવામાં આવ્યું હતું.

### એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત

એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત તા. ૧૯-૮-૨૦૧૩ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે લેખિકાઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં ઉપરિયત બહેનોએ પોતાની સ્વરચિત અપ્રકાશિત કૃતિઓનું પઠન કર્યું હતું. કૃતિવાંચન પછી રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં સર્વશ્રી ડૉ. લીનાબહેન ત્રિવેદીએ પંખીજગતની સંવેદના દર્શાવતી બાળવાતર્નાં, માલિનીબહેન શાસ્ત્રીએ બે બાળકાળ્યોનું, રસીલાબહેન કડિયાએ ‘ધોકો’ કૃતિનું, દીનાબહેન પંડ્યાએ ‘ધરવખુ’ વાર્તા અને ભારતી સોનીએ ‘જંગલમાં મંગલ’ બાળનાટકનું વાંચન કર્યું હતું.

પ્રશ્ના પટેલ

## પાક્ષિકી અંતર્ગત

તા. ૨૫-૭-૨૦૧૩ના રોજ અભિમાન્યુ આચાર્ય અને સાગર શાહે 'માર્ગો' વાલ્ડો સુપર માર્કેટ'માં અનૂદિત કૃતિ વાંચી હતી. જેમાં ઉપભોગવાદી બજારતંત્રની ભીસમાં ભીસાતા માણસની કથા ઘણી રસપ્રદ રીતે કહેવાઈ હતી. અનુવાદ સરસ રીતે કર્યો હતો તેથી કથા દરેકને સ્પર્શી ગઈ હતી.

તા. ૧-૮-૨૦૧૩ના રોજ પૂજા તત્ત્વસ્તુ 'સ્વીએ ઓફ' વાર્તાનું પઠન કર્યું હતું. જેમાં ઘર છોડી ગવેલા પતિની ગેરહાજરીમાં સ્વીની મનોવેદનાનું સુંદર ચિત્રણ થયું હતું. વાર્તાની શૈલી અને સૂક્ષ્મ અવલોકનોએ વાર્તાનું મહત્વ વધાર્યું હતું.

તા. ૧૫-૮-૨૦૧૩ના રોજ હસમુખ રાવલે નિબંધ 'એક પગલું આકાશમાં'નું પઠન કર્યું હતું. જેમાં પોતાના પ્રથમ વિમાની પ્રવાસનું ભાગ્યે જ રજૂ થયું હોય એવું સરસ વર્ણન સાંભળવા મળ્યું ભાવકોએ નિબંધની પ્રશંસા કરી હતી.

દ્વારાન ઠકોર



## ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન

ગુજરાતી સાહિત્ય પરિષદના સુડતાલીસમા અધિવેશનનું આયોજન એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજના યજમાનપદે આણંદ મુકામે તારીખ : ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૧૩ના ત્રણ દિવસ યોજાશે.

અધિવેશન સ્થળ : એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ

ઉદ્ઘાટન સમારંભ : તા. ૨૪-૧૨-૨૦૧૩ મંગળવાર,

બેઠક પહેલી : કવિતા - સાહિત્યસ્વરૂપ - કેદ્દિયત. તા. ૨૪-૧૨-૨૦૧૩

મંગળવાર, બપોરે ..

અધ્યક્ષ : માધવ રામાનુજ

વક્તા : છાંદસ : હરીશ મીનાશુ

નીતિ : મનોહર ત્રિવેદી,

ગાંધી : જલન માતરી

બેઠક બીજી : આસ્વાદ બેઠક : રાજેન્દ્ર શાહની કવિતાઓ

તા. ૨૪-૧૨-૨૦૧૩ મંગળવાર, રાત્રે ૮.૩૦થી ૧૦.૦૦

અધ્યક્ષ : ધીરુ પરીખ

સંયોજક : પરેશ નાયક

તા. ૨૫-૧૨-૧૩ બુધવારના રોજ સવારે ૮.૦૦થી ૮.૩૦

ગુજરાતી સાહિત્ય પરિષદની નવી/જૂની મધ્યસ્થ સમિતિ અને

કાર્યવાહક સમિતિની સંયુક્ત બેઠક

## બેઠક નીતિ : વિવેચન-સંશોધન

તા. ૨૫-૧૨-૧૩ બુધવાર

સવારે ૮.૩૦થી ૧૨.૩૦

અધ્યક્ષ : અજિત ઠાકોર

વક્તાઓ : હર્ષવિદુન ત્રિવેણી, હસિત મહેતા, રાજેશ પંડ્યા

બેઠક ચોશી : પરિસંવાદ : શિક્ષણના માધ્યમ તરીકે સાહિત્ય તા. ૨૫-૧૨-૧૩ બુધવાર,  
બપોરે ૩.૦૦થી ૬.૦૦

અધ્યક્ષ : આર. બી. શાહ

વક્તાઓ : શિક્ષણ અને સાહિત્ય : ધવલ મહેતા

સમૂહ માધ્યમ અને સાહિત્ય : રઘુવીર ચૌધરી

સાહિત્યના પ્રસારના પ્રશ્નો : સુદર્શન આયંગર

બેઠક પાંચભી : વજ્માન સંસ્થા આયોજિત કાર્યક્રમ

તા. ૨૫-૧૨-૧૩ બુધવાર, રાત્રે ૮.૦૦થી ૮.૩૦

બેઠક છણી : સમાપન બેઠક તા. ૨૬-૧૨-૧૩ ગુરુવાર, સવારે ૮.૩૦થી ૧૨.૦૦

- ગુજરાતી સાહિત્ય પરિષદનું ખુલ્લું અધિવેશન અને સમાપન બેઠક

- ઠરાવો : પ્રતિભાવો અને આભારવિધિ

- બપોરના ભોજન પછી અધિવેશનની સમાપ્તિ થશે.

નોંધ : અધિવેશનમાં ભાગ લેવા ઈચ્છતા પ્રતિનિધિઓને ભોજન-ઉતારા શુલ્ક રૂ. ૩૦૦/- તથા પ્રતિનિધિ શુલ્ક રૂ. ૨૦૦/- ભરવાના રહેશે. કુલ રૂ. ૫૦૦/- થશે.

વિદ્યાર્થીઓએ ૫૦% રકમ ભરવાની રહેશે (કાર્યક્રમનો અહેવાલ રજૂ કરનાર વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવશે)

ભોજન-ઉતારા અને પ્રતિનિધિ શુલ્ક તા. ૧૫-૧૨-૧૩ સુધીમાં પરિષદ કાર્યાલય, અમદાવાદમાં ભરી ટેવાથી વ્યવસ્થા સરળ થશે. ત્યારબાદ સ્વીકારવામાં આવશે નહીં.



## સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમનો ઉરમો વાર્તાશિબિર

શ્રીમતી કટ્યનાબહેન અને જિતેન્દ્રભાઈના યજમાનપદે અતિથિમંદિર, મુનિસેવા આશ્રમ, ગોરજમાં તા. ૧૦ અને ૧૧ ઓંગસ્ટ, ૨૦૧૩ના રોજ સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમનો ઉરમો વાર્તાશિબિર સંપન્ન થયો. સંયોજકશ્રી સુમન શાહે ઉરમા વાર્તા શિબિરની ભૂમિકા અને સુ. જો. સા. ફો.ના ઉદ્દેશોની વાત કરી શિબિરનો પ્રારંભ કર્યો હતો. તેમના માર્ગદર્શનમાં સર્વશ્રી રાજેન્દ્ર પટેલ, સંજય ચૌહાણ, પ્રમુદાસ પટેલ, નીતિન ત્રિવેદી, ધનરાજ કોઠારી, અઞ્ચય ઓળા, કટ્યના જિતેન્દ્ર, વિપુલ વ્યાસ, જિજોશ બ્રહ્મભણી, રામ મોરી, જિજોશ જાની, મહેન્દ્રસિંહ પરમાર, સાગર શાહ, અભિમાન્યુ આચાર્ય, સંજય ચૌધરી, જનક રાવલ, ભારતીયહેન દલાલ વગેરેએ પોતાની અપ્રગત વાર્તાઓ રજૂ કરી હતી અને બધા જ સર્જકોએ ટૂંકી વાર્તાના અનુલક્ષણમાં પૂરી સતર્કતાથી વિશદ ચચાઓ કરી હતી. સુમન શાહે ઉરમા વાર્તા શિબિરની ભૂમિકા અને સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમના ઉદ્દેશોની વાત કરી શિબિરનો પ્રારંભ કર્યો હતો.

### કવિસંમેલન

પ્રેમાનંદ સાહિત્ય સભામાં ચાલતી બુધસભાના કવિઓનું સંમેલન તા. ૨૪-૭-૨૦૧૩ના રોજ સાંજે ર. વ. દેસાઈ હોલમાં યોજાયું હતું. આ કવિસંમેલન ખલિલ ધનતેજવીની અધ્યક્ષતામાં યોજાયું હતું. રશીદ મીરે સ્વાગત કરીને બુધસભાની ભૂમિકા બાંધી આપી હતી. આ કવિસંમેલનમાં સર્વશ્રી ભરત ભણ પવન, મનહર ગોહિલ, દિના શાહ, હસમુખ શાહ, કીર્તિકાન્ત પુરોહિત, રશીદ મીર, ખલિલ ધનતેજવી, મહેશ બ્રહ્મભણી, દિનેશ ડેંગરે નાદાન, વિરચિ ત્રિવેદી વગેરે ૨૫ કવિઓએ કવિતાપદ્ધતન કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા.

### વ્યાખ્યાનો

#### શ્રી ચંદ્રકાન્ત શેઠનું 'પ્રેમાનંદનું ભાષાકર્મ' વિશે વક્તવ્ય

શ્રી ભર્દુંકર વિદ્યારીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાન-શ્રોણી અંતર્ગત શ્રી ચંદ્રકાન્ત શેઠ પ્રેમાનંદનું 'ભાષાકર્મ' વિશે વક્તવ્ય આપતો કદ્યું હતું કે, આપજા ઉત્તમ સર્જકોમાં એક તે પ્રેમાનંદ. ઉમાશંકરે કહેલું કે ગુજરાતી ભાષાએ પોતાનું હથય બે સર્જકો આગળ ખોલ્યું છે. તેમાંના એક તે પ્રેમાનંદ. પ્રેમાનંદ પાસે વાલ્મીકી વ્યાસની રામાયણ, મહાભારતની પરંપરા તો પૌરાણિક ગ્રંથોની ભાગવતાદિની પરંપરા હતી. તે આત્મસાત્ર

કરીને ભારતીય સંસ્કાર તેમજ સંસ્કૃતિની ભૂમિકા પર રહીને તેમજે ભગવાન, ભક્ત અને ભક્તિની અનેક કથાઓ આપી છે.

**શ્રી પ્રકાશ ન. શાહનું ‘આચાર્ય કૃપાલાની સવા શતાબ્દીએ’ વિશે વક્તવ્ય**

શ્રી ભદ્રકર વિદ્યાધીપક જ્ઞાનવિજ્ઞાન વાખ્યાન શ્રેષ્ઠી અંતર્ગત શ્રી પ્રકાશ ન. શાહે ‘આચાર્ય કૃપાલાની સવા શતાબ્દીએ’ વિશે વક્તવ્ય આપતાં કહ્યું કે, કૃપાલાની એમ કહેતા કે હું બહુ મહત્વાકાંક્ષી નથી. ભાષાચાર સામે કામ કરી શકાય તેવું કામ કૃપાલાની માગતા તેની જવાબદારી લઈ. કેટલાક માણસોમાં મૌલિક વિચારોની આવડત હોય છે. કૃપાલાની હિમાલય અમણાના શોખીન હતા. ભોગીલાલ ગાંધીએ કૃપાલાનીને અવધૂત તરીકે ઓળખાવ્યા છે. કૃપાલાનીને ગરીબો માટે સાચો પ્રેમ અને લાગડી હતા. તે ભગવદ્ગુરુદય માણસ હતા.

**શ્રી રત્નલાલ બોરીસાગરનું ‘હાસ્ય દ્વારા જીવનદર્શન’ વિશે વક્તવ્ય**

તા. ૧૪-૮-૨૦૧૭ના રોજ ‘વિશ્વકોશભવન’માં ‘હાસ્ય અને જીવનદર્શન’ વિષય પર શ્રી રત્નલાલ બોરીસાગરે જ્યોતિન્દ્ર દવે, બડુલ ત્રિપાઠી, વિનોદ ભણ, નિર્ંજન વિરેઠી, પુ. લ. દેશપાંડે વગેરે હાસ્યકારોની રચનાઓ દસ્તાવેજો સહિત રજૂ કરી હસતાં-હસવાતાં હાસ્યરસની કૃતિઓમાં જીવનનું પ્રતિબિંબ કેવું લિખાય છે તેની વાત કરી હતી.

**ઉદ્યપુરમાં ડૉ. કેશુભાઈ દેસાઈએ ‘મીરાં સમારોહ’ પ્રસંગે બીજ વક્તવ્ય આપ્યું**

રાજ્યાન સાહિત્ય અકાદમી દ્વારા ઉદ્યપુર ખાતે આયોજિત ‘મીરાં સમારોહ’માં શ્રી કેશુભાઈ દેસાઈએ બીજ વક્તવ્ય આપતાં કહ્યું કે, મીરાંભાઈ એ આપણી રાષ્ટ્રીય ધરોહર છે. મીરાંએ સામંત્યયુગમાં વિક્રોહી નારી તરીકે રાજસત્તા સામે બળવો કરીને વિધવા થયા પછી પણ સત્તી નહીં થવાનું પસંદ કર્યું હતું અને પોતે શ્રી કૃષ્ણને વરી ચૂકી હોઈ અખંડ સૌભાગ્યવતી હોવાની જાહેરત કરી હતી.

**“સંચયન”**

**ગુજરાતી શિષ્ટ ઈ-સામયિક**

મિત્રો,

અમેરિકા-સ્થિત “એકત્ર” ફાઉન્ડેશન નામની અમારી વિદ્યા સાહિત્ય સંસ્થાએ શિષ્ટ સાહિત્યનાં ૧૦૦ ગુજરાતી પુસ્તકો પ્રગટ કરવાની યોજના સાથે જ, “સંચયન” નામે એક ગુજરાતી સાહિત્ય-સામયિકનો આરંભ કરવાનું નક્કી કર્યું છે – એનો પહેલો અંક “એકત્ર”ના પ્રાગટ્ય રૂપે સૌને સપ્રેમ ધરીએ છીએ.

“એકત્ર”ની પ્રવૃત્તિઓ માટે જેમ આપજા પ્રથિતયશ સર્જક-વિવેચક શ્રી સિતાંશુ યશશ્વરનું માર્ગદર્શન મળી રહ્યું છે, એમ આ “સંચયન” સામયિકનું સંપાદન આપણા પ્રતિષ્ઠિત વિવેચક-સંપાદક શ્રી રમણ સોની કરી રહ્યા છે. સાંપ્રત સાહિત્ય-સામયિકોમાંથી

તેમજ ગ્રંથોમાંથી ઉત્તમ અને રસપ્રદ કૃતિઓનું ચયન “સંચયન” દ્વારા સુલભ થશે.

ગુજરાતી ભાષામાં વિચારપત્રો, વ્યાપક વાચનનાં તેમજ સાહિત્યનાં સામયિકો ઘણાં છે. એમાં કેટલાંક વધુ મહત્વનાં છે. પરંતુ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ સુધી એ પહોંચી શકતાં નથી. અને પહોંચાડવાં અત્યંત મુશ્કેલ પણ છે. ઉપરાંત, અનેક સામયિકોમાંથી ઉત્તમ કયાં તે પસંદ કરવાનું ને એને મંગાવવાનું સૌ માટે અશક્ય છે. વળી, વાચનમાં રસ હોય તોપણ સમયના અભાવે, સામયિકો પૂરાં વાંચી શકતાં નથી. આ સંજોગોમાં આપણાં સામયિકોમાંથી ઉત્તમ સામગ્રીનું ચયન-સંકલન આપતા એક ઈ-ડાયલેસ્ટ દ્વારા ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને ઉત્કૃષ્ટ વાચન પહોંચાડવાનો એક સાહસિક પણ જરૂરી સંકલ્ય અમે કર્યો છે.

આપ એઈ આ link ઉપર ક્લિક કરીને ‘સંચયન’નો પહેલો અંક ખોલીને વાંચી શકશો. અનુકૂળતાએ વાંચવા આ pdf આપના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી રાખશો. પીડીએફ એક વખત ડાઉનલોડ કર્યા પછી ફરી ઇન્ટરનેટની જરૂર નહીં પડે અને આ પીડીએફ જ વાંચવા માટે વધુ અનુકૂળ પડશે.

ઓનલાઇન વાંચતી વખતે ઉપર જે ટુલબાર આવે છે તેનો ઉપયોગ કરીને મોકળાશથી વાંચવાની સુવિધા તમે તમારી રુચિ પ્રમાણે ઊભી કરી શકશો.

વાચકમિત્રોને પણ આ લિંક આગળ ફોર્વર્ડ કરી ‘સંચયન’ વહેંચી શકશો :

[issuu.com/ekatra/docs/sanchayan\\_1?e=4805530/4445157](http://issuu.com/ekatra/docs/sanchayan_1?e=4805530/4445157)

અમારી વેબ-સાઈટ <http://www.ekatramagazines.com> ઉપરથી પણ એ જોઈ શકશો. જે મિત્રો પોતાના email ID મોકલી આપશે એમને અમે વ્યક્તિગત પણ મોકલીશું. તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂરથી જણાવશો.

અતુલ રાવલ, પ્રકાશક-સંચયન એક્ઝ્યુફિશન

email : [atulraval@ekatrafoundation.org](mailto:atulraval@ekatrafoundation.org)

<http://www.ekatrafoundation.org>

### અભિનંદન

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તા. ૨૪-૮-૨૦૧૩ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે રામા વાટુમલ હોલ, કે. સી. કોલેજ, ચર્ચગેટ, મુખેંમાં ‘વીર નર્મદ પારિતોષિક-૨૦૧૩’ શ્રી ગુણવંત શાહને અર્પણ કરવામાં આવ્યું અને ‘જીવન ગૌરવ પારિતોષિક-૨૦૧૩’, ડૉ. દિલીપ જવેરીને આપવામાં આવ્યું હતું.

શ્રી ગુણવંત શાહ અને દિલીપ જવેરીને હાર્દિક અભિનંદન.